



વાવડ

શ્રી દક્ષિણ ભારત કચ્છી વિસા ઓસવાલ જૈન એક્કમનું
મુખપત્ર ઓક્ટોબર, ૨૦૧૭ અંક - ૬૦

Bharat Automobiles

Narendra N.Savla

No.50 & 5, Sir. M.V.Lorry Terminal,
Bellary - 583 101.

Ph. : (S) 272997, 272847, 275882

® 256133, Cell : 94480 72997

Email : bharatautomobiles1@gmail.com



SPECIALISTS IN : TATA, LEYLAND, JEEP, TIPPER, LCV, INDUSTRIAL SPARES

Bharat Sales & Service

Anil N.Savla

B.E. (E.&C)

S.No.17, Dr. Sir. M.V.Lorry Terminal,
Bellary - 583 101.

Ph. : 08392 - 272993.

Email : gudsi1@gmail.com



1st Floor, National Engg. Work,
Near Bharat Petrol Pump,

Bangalore Road,

Nh4, Kundgol Cross, Adargunchi,
Hubli-590 212.

Cell : 9845669294,

Ph. : 0836-2317993

Email : bss.hubli@gmail.com

Authorised Service Centre - Wabco TVS

Vavad વાવડ
October 2017 Issue no: 60

અનુક્રમણિકા



૧. પ્રમુખશ્રીનો સંદેશ	૪
૨. સંપાદકીય	૫
૩. તંત્રી સ્થાનેથી	૫
૪. વાવડને પ્રત્યુત્તર	૬
૫. ગીતાર્થ	૯
૬. ઘટકના વાવડ	૧૧
૭. શાંત પળોમાં વિચારજો	૨૧
૮. જીવનચક્ર	૨૨
૯. મહિલા MUNCH	૨૫
૧૦. પાકેલુ પાંદડુ	૨૭
૧૦.૧ ગમતાના ગુલાલ — સત્ય ઘટના— સાચને આંચ ન આવે	૩૧
૧૧. EDITOR'S MESSAGE	૩૨
૧૨. આગામી કાર્યક્રમ	૩૨
૧૩. EKKAM's GOT TALENT	૩૩

VAVAD IS ALSO AVAILABLE ON ASANJOKUTCH.COM

Details about KUTCHHI VISA OSWAL JAIN EKKAM is available on www.dbkvo.org

વાવડના તંત્રીઓ

શ્રીમતી રેખાબેન પ્રકાશ કેનિયા- 919663146467

શ્રીમતી ગીતાબેન વિરેંદ્ર છેડા-919448366364

શ્રીમતી નીલમ હિતેશ છેડા-919449226670



પ્રમુખશ્રી નો સંદેશ

પ્રિય સ્નેહી સ્વજનોને જય જીનેન્દ્ર,

આ વરસના અંતિમ ચરણના નગારો વાગી રહ્યો છે. સંપૂર્ણ વર્ષના Celebrity - છે GST અને નોટ બંદી. જેમના પ્રકાશમાં “મંદગતીમાં” ઘોડતા અમારા પર્વો - જેમ - આષાઢી બીજ - પર્યુષણ - દશેરા - દિવાળી અને આવતો વર્ષ. એમ તો દેશનું કલ્યાણ અને જાગૃતી એજ સંકલ્પ શ્રી પ્રધાન મંત્રી મોદીજી કર્યું હોય. થોડી કઠિનાઇઓ આવશે પણ પરિણામ સારાજ આવશે. પરિસ્થિતી પ્રતિકુલ હોય છે અનુકુલ હોય અમે બધાનેજ પ્રગતિશીલ થવું છે - આગળ વધવું છે. મક્કમ મનોબલથી સામનો કરવો છે.

આવનાર નવો વર્ષ ૨૦૧૮ આપ સૌ ને મંગલકારી અને આનંદમય થાવો એજ શુભકામના.

સબંધો બનતા રહે, એ જ બહુ છે,

બધા હશતાં રહે, એ જ બહુ છે,

હરેક જણ—હરેકસમયે, સાથે નથી રહી શકતા,

યાદ એક બિજાને કરતાં રહે, એજ બહુ છે.


Happy New Year

વિરેન્દ્ર દામજી છેડા (હુબલી), ૯૨૪૩૨૮૧૨૬૪



શ્રી દ.ભા.ક.વી.ઓ. જૈન એક્કમના હોદ્દેદારો

નં	નામ	હોદ્દો	ગામ	મોબઈલ નં
૧.	શ્રી વિરેન્દ્ર દામજી છેડા	પ્રમુખ	હુબલી	919243281264
૨.	શ્રી મણિલાલ પ્રેમજી ગાલા	ઉપ પ્રમુખ	ગુલબર્ગા	919448110141
૩.	શ્રી નિતીન કુમાર શાહ	ઉપ પ્રમુખ	હૈદ્રાબાદ	9189784444848
૪.	શ્રી યુનીલાલ જીવરાજ ગાલા	ઉપ પ્રમુખ	બેંગલોર	919844056842
૫.	શ્રી વિસનજી વિરજી ગંગર	ઉપ પ્રમુખ	ચેન્નઈ	919380555999
૬.	શ્રી નિતીન એસ શાહ	ઉપ પ્રમુખ	મદુરાઈ	919344440144
૭.	શ્રી નરેન્દ્ર નાનજી સાવલા	સહ મંત્રી	બેલ્લારી	919448072997
૮.	શ્રી પંકજ વિરજી ગાલા	મંત્રી	ગદગ	919448137039
૯.	શ્રી મહેન્દ્ર ખીમજી વીરા	ખજાનચી	ગદગ	919448356488



સંપાદકીય



પ્રિય વાચક મિત્રો, જય જિનેન્દ્ર,

તક્ત પર હુકુમત બદલાઈ, દેશ પણ બદલાયો, હવે સમાજ પણ બદલાય છે, ઘરઘરમાં જાગરુકતા આવા છે, વ્યક્તીગત રિતે બદલાવ દેખાય છે. મનમાં ઊમેદ જાગી છે કે હવે બધુજ સારુ થશે. એક પ્રસંગ યાદ આવે છે બોબ મનરોની.

બોબ મનરો કેનેડીયન આઈસ હોકીની નેશનલ ટીમના ખુબ સારા પ્લેયર હતા. નેશનલ ટીમમાંથી નિવૃત્તિ લિધા બાદ સામાજીક સેવાઓ કરવા માટે એ યુનોમાં જોડાયા અને આફ્રીકામાં એમની સેવાઓ આપી રહ્યા હતા. એક દિવસ બોબ મનરો એમની કારમાં બેસીને આફ્રીકામાં આવેલી દુનિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી પાસેથી પસાર થઈ રહ્યા હતા. 'મથારે' ખુબ મોટા વિસ્તારમાં ફેલાયેલી ઝુંપડપટ્ટી છે. બોબ મનરોએ જોયું તો ખુબ મોટા સંખ્યામાં યુવકો એકઠા થયેલા હતા અને બધા કઈંક પકડવા માટે મથામણ કરી રહ્યા હતા. બોબ મનરોએ એમની ગાડી ઉભી રાખી એમણે જોયું કે આ બધા યુવાનો કુટબોલ રમી રહ્યા હતા. કુટબોલ કપડાના ટુકડામાંથી બનાવેલો અને રમવાવાળાની સંખ્યા એટલી મોટી હતી કે કોઈ કુટબોલને પગથી લાત મારે એ પહેલા તો બીજો યુવક એમને લાત મારીને નીચે પાડી દે. બોબ મનરોએ યુવાનોને પાસે બોલાવી પોતાની પાસે રહેલા પેમ્ફ્લેટમાં થી કુટબોલનું ચિત્ર બતાવીને કહ્યું, "તમે જે બોલથી રમો છો એ બોલ ન ચાલે, કુટબોલ રમવા માટે આવો બોલ જોઈએ. હું તમારા માટે કાલે આવો બોલ લઈ આવીશ." બધા યુવાનો ખુબ રાજી થયા. બીજા દિવસે બોબ મનરો આ યુવાનો માટે થોડા કુટબોલ લઈને આવ્યા.

બોલ યુવાનોને આપતા પહેલા કહ્યું, "તમારે આ બોલથી રમવું હોય તો એના માટે સારુ મેદાન જોઈએ એટલે ગંદગી સાફ કરીને મેદાન તૈયાર કરો." યુવાનોને તો કુટબોલ થી રમવું હતું એટલે એમને ઝુંપડપટ્ટીની આસપાસની ગંદકી સાફ કરીને મેદાન બનાવ્યા. નિયમ મુજબજ કુટબોલ રમાય એ માટે 1987ની સાલમાં 'મથારે કુટબોલ ક્લબની' સ્થાપના કરવામાં આવી. આ ક્લબના સભ્ય બનવું હોય તો એ માટે ફરજિયાત ભણવાનું એટલે યુવાનોએ ભણવાનું પણ શરુ કર્યું. ધીમે ધીમે ઝુંપડપટ્ટીની ગંદકી સાફ થવા લાગી. યુવાનોએ ભણવાનું ચાલુ કર્યું એટલે એમના વિચારો પણ બદલાયા. બોબ મનરોની નાની એવી શરુવાત થી ગઝબનું પરિવર્તન આવ્યું. હજારો યુવાનો ક્લબમાં જોડાયા અને આશ્ચર્યની વાત એ છે કે બોબ મનરોએ 1987માં આ કાર્યની શરુવાત કરી અને 8 વર્ષ બાદ 1991 માં કેનેડીયન કુટબોલ ટીમના તમામ 11 ખેલાડીઓ મથારે ઝુંપડપટ્ટીના યુવાનો હતા.

દોસ્તો, પરિવર્તન રાતોરાત ન આવી જાય. પરિવર્તન તરફનું પ્રથમ પગલું ખુબ નાનું હોય પણ સમય જતા સાચી દિશામાં ઉઠાવેલું પગલું કલ્પના પણ ન કરી શકાય એવું મોટું પરિવર્તન લાવી દે છે. દેશમાં પરિવર્તન દેખાય છે અને સમાજમાં પણ. તમે એવો કોઈ પ્રસંગ કે પરિવર્તન ની અનુભુતી થઈ હોય તો વાવડને જરુર મોકલજો.

નવા વર્ષની શુભકામનાઓ સાથે

નરેન્દ્ર નાનજી સાવલા, પ્રમુખ, બેલ્લારી, ૯૪૪૮૦૭૨૯૯૭



જય જિનેન્દ્ર,

તંત્રી સ્થાનેથી



“સંગાથે સુખ શોધીએ, રસીએ એક હુંફાળો માળો.”

દામ્પત્યનું બીજું નામ સંગાથ. હજુ અહિંયા જુનાગઢ જેવા વિસ્તારમાં તો મકાન ના આર્કીટેક એટલું ધ્યાન રાખે છે કે પંખીઓ આવી જઈ શકે છે. સમાજ જીવન પણ એવુંજ છે કે દાદા-દાદીની તસ્વીરો પણ ભીંત ઉપર મળે છે. મહાનગરોમાં હવે એ લુપ્ત થતું જાય છે. ઘરની ડીઝાઈનો પણ એવી બને છે કે પંખીઓને પણ આવવા-જવાની જગ્યા નથી અને પંખાઓ જેના માટે પહેલા આવતા દાદા-દાદીના ફોટો પાછળ માળો બાંધવા, એ હવે ફોટોને પણ જગ્યા નથી. હવે ઘર આપણું હોય છે ને ડિઝાઈન ઈન્ટીરીયર ડિઝાઈનર જેમ કહે તેમ થાય છે. ઈન્ટીરીયર ડિઝાઈનરને આપણા દાદાની ફોટોની ફેમ દિવાલના રંગ સાથે અનુકૂળ નથી લાગતી. એટલે પહેલુજ એમ કહે છે, કે આ હટાવી લ્યો. દાદા-દાદીને તો હટાવીજ લીધા છે. હવે આ ફોટાની ફેમ પણ દુર કરી દો. અસલ તો એ ફોટાની પાછળ ચકા-ચકી માળો બાંધતાં એ જોવાનું હવે નવા પેઢીને મલ્યું નથી. એટલે જ એ સંગાથ નો અર્થ સમજતા નથી. જેમણે ચકા-ચકીને માળો

બાંધતા જોયા હશે, એમને ખબર પડે કે બન્ને ઉડે છે ને ઉડી ઉડી ને તણખલા લાવે છે. ચકાને ચકીના માળામાં બેઉની પસંદગીના તણખલા હોય છે.કોઈ એકનાઆગ્રહના તણખલા નથી હોતા એટલે એમનો માળો લાંબો ટકે છે. એમને વાસ્તુ-પુજા ને ઘરશાંતી-ગૃહશાંતીની જરૂર નથી પડતી. પણ આપણને વારંવાર પડે છે. બધુંજ કરાવ્યું હોય છે તો પણ કેટલા બધા પ્રશ્નો નડે છે. આપણને સમજાતું નથી કે આ શું નડે છે. આંટી મુકીદેવી જોઈએ. બેઉ જણાઆંટી મુકી દે તો આ થાય. પેલી બાળવાર્તા આ રીતે મહત્વની હતી. આ સાંસે વાર્તા સાંભળીને બાળપણ શરૂ કર્યું છે.

એક હતો ચકો ને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો - ચકો લાવ્યો મગનો દાણો. એ વખતે તો આ વાર્તા કાન પાસે થી પસાર થઈ ગઈ પણ એ સમજાયું કે કેટલી મોટી વાત છે. અહિયાં પણ કોઈ એકજ જણની આજ્ઞા કે આધીપત્ય નથી, ચકો અને ચકી બન્ને ઉડે છે. બન્ને પોતાની ઈચ્છા પ્રમાણે ચોખા નો કે મગનો દાણો લાવે છે.એમના ઘરમાં જે ખાચડી બની છે, એમા બન્નેની પસંદગી છે. બન્ને લાવેલા ચોખા ને મગના દાણા છે. અને સૌથી સુપાત છે એવી ખીચડી બનાવી છે, કે પચાવવાની પણ અઘરી ન હોય, પણ જે બે માથી એટલે કે ચકાને ઈચ્છા થઈ કે હું એકલો આ ખાઈ જાઉં એટલે કારીઓ કુતરો પ્રવેશે છે. જીંદગીમાં બન્નેની પસંદગીનો આધાર વ્યક્તિત્વ ને અસ્તિત્વ બન્ને આ બન્ને ના પતી-પત્નીના અલગજ હોયે છે. એનો આદર કરતા શીખવું પડશે.

આપણું બહુ સરળતાથી પાનના ગલ્લે પીચકારી મારી દેવાય એવું વાક્ય છે. I LOVE YOU (આઈ લવ યુ) આમ જુવો તો મંત્ર વાક્ય છે. પુરી પ્રતીબંધતા થી બોલવું હોય તો કદાચ જીવન ટુંકું પડે. અંગ્રેજી વાક્ય રચના છે. એનો પ્રથમ I છે. કહેવું હોય કે હું તમને ચાહું છું. ઓળ-ગોળ છું જેના ઉપર એને કહેવું છે પણ છતા પહેલા I જ આવે છે અને કેપીટલ જ આવે છે. હું ઓગામવો સહેલો નથી જેને ચાહો છો તે YOU છે. વાક્યમાં સોથી છેલ્લે છે. આ I અને YOU વચ્ચે LOVE છે. આ LOVE એ શેતુ છે અને એજ જીવનનો હેતું છે. તો એ વાક્ય મંત્ર વાક્ય બન્ને છે. તો આ બોલવા માટે પ્રતીબંધતા જોઈએ. દાંપત્યની એ આખી પ્રક્રિયા લગ્નની વિધિ છે. એમાં સાતમી પ્રતિજ્ઞા સૌ જાણો છો. ‘સખે સપ્તપદી ભવ’ સાત પગલા સાથે ચાલિને આપણે એક-મેકના મિત્ર થયા. આ ભારતીય પરંપરા છે. આ પશ્ચિમની સમજતો હવે આપણને ઉધારની મલી ગઈ છે એટલે આપણે રાજીયો કરીએ છીએ. પણ આદેશ કયાંય પણ એવું નથી કિધુ કે તમે મારા ધણી છો. તમે મારા નાથ છો આવો કોઈ ભાવ જ નથી. દામ્પત્યનું પરમ શિખર શાખ્ય છે. એના માટે બે જણા ભેગા થાય છે. હવે તો લગ્ન થયે એટલા વરસ વિતી ગયા એટલે ઘણું બધું યાદ ન હોય. પણ માંડવામાં જે એક-બીજાને જમાડીયું હશે એ છેલ્લી વાર જમાડીયું હશે. હવે તો હાથમાં બિયારા મેંદી મુકે છે બેન તો પણ ભાઈ તૈયાર નથી હોતા એ નીમીત્તે પણ કોળિયો ભરાવવામાટે, એવા જે “લાડો-લાડી” જમે કંસાર, કંસાર કેવો મીઠો લાગે છે. એમા પણ પતી પહેલા કોળિયો ભરાવે છે. ચાર કોળિયા ભરાવતી વખતે એ પ્રતિજ્ઞા લે છે કે તારા યોગક્ષેમની જવાબદારી મારી છે. તારું ગૌરવ હવે મારી જવાબદારી રહશે. તારું અસ્તિત્વ અને વ્યક્તિત્વ બન્નેના વિકાસમાં તોજ મીઠાશ વધશે. એટલેજ તો કંસાર જમાડે છે. પણ એ જમાડે છે તે દરમ્યાન જે મંત્રો છે તે ભારતીય ચિંતન પરંપરા દામ્પત્યનું શું સાચો અર્થ છે એને ખોલે છે. એ પ્રથમ કોળિયો પ્રાણ સાથે પ્રાણના મિલનનો છે.બીજો કોળિયો મગજ સાથે મગજ નો(સ્નાયુ), ત્રિજો કોળિયો અસ્થી(હાડકા) સાથે અસ્થિ, ચોથો કોળિયો ત્વચા સાથે ત્વચા.

આપણી ભારતીય પરંપરા બે જણનું મળવું પ્રાણ સાથે પ્રાણનું મળવું મહત્વનું ગણે છે. ત્વચા તો બહુજ સુપર ફ્લીવર્ય છે. તે તો છેલ્લે આવે છે. મળવાનું તો પ્રાણ સાથે પ્રાણ છે. ત્વચા સાથે ત્વચા તો અનું સાંગીક છે એતો બાય-પ્રોડેક્ટ તરીકે થતી ઘટના છે. બે જણના પ્રાણ એક-મેક સાથે મળવા જોઈએ એનું નામ દામ્પત્ય છે.

રેખા પ્રકાશ કેનિયા, બેલ્લારી, ૯૬૬૩૧૪૬૪૬૭




વાવડને પ્રત્યુત્તર

Vavad is thankful to all the readers. Vavad is grateful to the writers for their contribution of articles and poems.

Photos from Gadag





ATITHI

TOURS AND TRAVELS

TREAT YOU LIKE ONE IN THE ROYAL ERA

**Quality AC Cars and Buses on Rent
Daily City Sight Seeing and Out Station**

- **Wonderla Amusement Park**
- **Ramoji Film City**
- **Chilkurbalaji**
- **Sreesailem**



9848011007, 9246591107

E-Mail : tushar.atithirentacar@gmail.com
6-3-252/2/2, Erramanzil, Hyderabad-82.



ગીતાર્થ



“ઠગવા વિભૂ આ વિશ્વને, વેરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા,

વિદ્યા ભણ્યો હું વાદ માટે,કેટલી કથની કહું? સાધુ થઈને બહાર થી દાંભિક અંદર થી રહું”

રત્નાકર પચ્ચીશીની આ નવમી ગાથા. શું છે આનું અર્થ ? અદભુત અલૌકિક, અણમોલ પરંતુ પુણ્ય જ્યા અધુરૂ છે..... કાળ જ્યાં પડતો છે..... વાતાવરણ અતિ દુષિત છે..... શાસન, સાધન, સામગ્રી પામવાં છતાં આપણ જ્યારે એનું સદુપયોગ નથી કરી શકતા,ત્યારે આ પોતાની સ્થિતિ માટેઅત્યંત મુંઝવણ અંતરમાં ઉભરાય છે.આ મારી કે તમારી વાત નથી, સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા બધાની પરિસ્થિતિ દિવસે-દિવસે ઘણીજ વિકટ થતી જાય છે. ”વીર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું આ જયવંતુ શાસન!” વીર પરમાત્માની વિદાય પછી,અચાનક અંધકાર છવાઈ ગયો. સાધક સાધનાના માર્ગે આગળ વધવા ઈચ્છતા છતાં ‘ગોથા’ ખાઈ રહ્યા છે. આપણે જ્યારે જ્યારે મુહપત્તી પડીલેહન (પ્રતિલેખન) કરીએ ત્યારે ત્યારે કહીએ છિએ સુદેવ-સુગુરૂ-સુધર્મ આદરૂં, કુદેવ-કુગુરૂ-કુધર્મ પરિહરૂં..... પણ સુદેવ-ગુરૂ-ધર્મ એટલે શું? સુદેવ-સુગુરૂ-સુધર્મ કોને કહેવાય? એ આપણને જાણતા નથી. કલીયુગનો પ્રભાવ કહો કે આપણા પાપનો ઉદય કહો- જગતનાં કુગુરૂઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે : સુગુરૂઓની સંખ્યા ઘટી રહી છે. આજે સમાજ ભૌતિક સુખનો રસિયો બન્યો છે અને આ નબળી કડીને પકડીને કુગુરૂઓ પોતાની જાળ પાથરે છે.

૧. પર્સનલ ટ્રસ્ટ - વિહાર ધામ - વૈવ્યાવચ્છ કેંદ્ર
૨. સમાચારી ભેદ થતાં સંઘોની જુદી સ્થાપના
૩. સ્થિર વાસનો સમય આવતાં પહેલા પર્સનલ ઉપાશ્રય - ફ્લેટ- બંગલા
૪. જ્યોતિષ -નિમિત્ત દોરા - ધાગા -તંત્ર-મંત્ર-ચંત્ર -ઔષધ ચાતુર્માસ માં પણ કમીટમેંટ (બદલામાં રૂપિયા)
૫. પૈસા આપી છોકરાઓ ખરિદી -દીક્ષા અપાવવી
૬. ધાર્મિક દરેક પ્રસંગોમાં પોતાનાજ પત્રિકા-ફોટોગ્રાફર-કેટરર્સ-ડેકોરેશનવાળા આવે અને બીજાથી ચડીયાતા દેખાવાની દોડભાગ
- ૭.પોતાનું જુદૂ માસિકપત્ર, રોજના સમાચાર ટ્રસ્ટની વિગતો - પુસ્તક છાપવા.
- ૮.પોતાના નામની તકતીની ડીમાંડ

આ બધું શું સુચવે છે? સમાજ આવા સાધુ-સાધ્વીજી ભગવંતોની પાછળ તૃષ્ણાના કારણે દોડી રહ્યા છે. ચારિત્ર ખુબ ઉંચુ પાડે પણ વ્યવહારિક ની નામે શૂન્ય. જીનાલયો કરવા દાદાવાડી ખુબ મોટી બનવા લાગી. ચાતુર્માસમાં ગણત્રીનો ગ્રાફ સૌથી વધારે જોવેજ. તેમા વળી રસોડામાં મિષ્ટાન- ફરસાણની આઈટમો ચઢીયાતી જ જોવે. પ્રભાવના માટે સોના - ચાંદી સુધીની લાણીઓ. જન્મદિન -સંચમદિન - તપ - તીર્થયાત્રા ના ઉજમણા.

ધર્મપ્રેમી શ્રાવકો સાવધાન બનો. ધર્મને સમજો. ઉપર જણાવેલ બાબતો તે ધર્મ નથી. સુગુરૂનો આચાર નથી. વિતરાગના તત્વઉપર શ્રદ્ધા રાખો.

“કર્મથી અધિક અને સમયથી પહેલા,

કાંઈ પણ આપવાની કોઈની પણ શક્તિ નથી.”

ગુરૂ દીવો - ગુરૂ દેવતા, વિણ ગુરૂ ઘોર અંધાર,

જે ગુરૂ વાણી વેગળા, તે રજવાળીયા સંસાર

જ્ઞાની ગુરૂ ભગવંતની ભક્તિ જીવને તીર્થકંર પદ સુધી પહોંચાડવા સમર્થ છે. આવી અપુર્વ શક્તિ જે ગુરૂ ભગવંતમાં છે એવા ગુરૂ પણ હોવા જોઈએ? આવા ગુરૂ ભગવંતો સમય આવે ત્યારે ત્યાગ અને બલીદાનની ચરણ સીમાએ પહોંચીને, પણ શાસનને વફાદાર રહે છે. ધર્મવચને ભક્તિની “ગરીમાં”ને જ્વલંત રાખે છે.....


(વ્યાખાન ના આધારે)

Photos from Hubballi



Photos from Bangalore





ઘટકના વાવડ

શ્રી ક.વી.ઓ.જૈન સમાજ

બેંગલોર

કચ્છી નવું વર્ષ અષાઢી બીજ

કચ્છી નવું વર્ષ અષાઢી બીજ ઉજવવા સમાજના સૌ સભ્યો સવારના શ્રી ભારતીય વિદ્યા ભવન મધે મળ્યા હતા. સવારનો નાસ્તો કરી સૌ ઓડિટોરિયમમાં ભેગા થયાં હતાં. કાર્યક્રમની શરૂઆત શ્રી ઉદયભાઈ ભેદા દ્વારા નવકાર મહામંત્ર થી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમાજના પ્રમુખ શ્રી પરેશભાઈ ગાલા એ સૌ ઉપસ્થિત સભ્યોને આવકાર્યાં હતાં અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. ત્યાર બાદ ૫ વર્ષ સુધીના બાળકો માટે STATE COSTUMES – રાજ્યોના વસ્ત્રપરિધાન થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, વિવિધ રાજ્યો-મહારાષ્ટ્ર, ગોઆ, નાગલેન્ડ અને ગુજરાત રાજ્યોના વસ્ત્ર પરિધાનમાં બાળકોએ પોતાની રજૂઆત કરી હતી. ત્યાર બાદ ૫ વર્ષથી ઉપરના વય ગ્રુપ દ્વારા ટેલન્ટ શો સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. સ્પર્ધામાં તબલા, કચ્છનો ખેડૂત, સ્વચ્છ ભારત અભિયાન મેસેજની આગવી રજૂઆત, હિન્દી કાવ્ય, ફિલ્મી ડાન્સની રોમાંચક રજૂઆત કરવામાં આવી હતી.

સ્પર્ધાના વિજેતા:

ફેન્સી ડ્રેસ: ૧- નિહાર સાગર છેડા- નાગાલેન્ડ ૨- રિયાન જિગર દેહિયા- ગુજરાત

ટેલન્ટ શો: ૧- આરવ તરુણ નાગડા- કચ્છનો ખેડૂત ૨- રીજુલ ચંદ્રેશ વીરા-ડાન્સ, ધીર ચંદ્રેશ વીરા-પિયાનો, આર્નવ જુગલ વીરા- તબલા.

વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન ધોરણ ૧૦ અને તેથી ઉપર ની પરીક્ષાઓમાં સફળ વિદ્યાર્થીઓ નું બહુમાન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. શિક્ષણિક સમારંભનું સંચાલન શ્રી સુશીલભાઈ સંગોઈએ કર્યું હતું. શ્રીમતી હિનાબેન તરુણ નાગડાએ વરસી તપ સાતા પૂર્વક પૂર્ણ કર્યું હતું, તે નિમિત્તે શ્રી તરુણભાઈ માવજી નાગડા કુટુંબ દ્વારા આ વર્ષના અષાઢી બીજ કાર્યક્રમના પ્રીતી ભોજન સ્પોન્સર કર્યું હતું. શ્રીમતી હિનાબેન અને શ્રી તરુણભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સૌનું મનોરંજન કરવા મેજેસિયન (જાદુગર) શ્રી જસ્ટીન ચાર્લ્સે અવનવા જાદુ રજૂ કર્યાં હતાં અને સૌને ખાસ કરીને બાળકોને ભરપૂર મનોરંજન પૂરું પડ્યું હતું. ત્યાર બાદ બેંગલોરના સૌથી નાની વયના કોમેડી આર્ટિસ્ટ માનવે પોતાની રજૂઆત કરી હતી. શ્રી તરુણભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ લકી ડીપ નો ડ્રો કરવામાં આવ્યો હતો. લકી કુટુંબ હતું: શ્રીમતી પુષ્પા વાડીલાલ દેહીયા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિધિ નીતિન મોતા અને મૈત્રી ભુપેન્દ્ર વિશરીયાએ આપણી માતૃભાષામાં સુંદર રીતે કર્યું હતું. ત્યાર બાદ શ્રી લક્ષ જૈન અને ડૉ શિલ્પા વોરાએ સમાજના યંગસ્ટર્સ સાથે વિચારોની આપલે કરી હતી. છેલ્લે સૌ પ્રીતી ભોજન માણી છુટા પડ્યાં હતાં.

પીકનિક: નવા સંવત વર્ષ ૨૦૧૮ને ઉજવવા પીકનિક નું આયોજન કરવામાં આવ્યું હતું. ગંગાનગર અને બસવનગુડીથી બે બસોમાં સભ્યો વાતો કરતા સવારની ગુલાબી ઠંડકમાં ૮:૪૫ વાગ્યે GARDEENIA COMFORTES SUITES રિસોર્ટ માં પહોંચ્યાં હતાં. રજીસ્ટ્રેશન યા નાસ્તો કરી સૌ રિસોર્ટની લોનમાં એકત્ર થયાં હતાં. શરૂમાં પ્રમુખ શ્રી પરેશભાઈ એ સૌ સભ્યોને આવકાર્યાં હતાં અને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. રમતોના સંચાલક દીપ્તિએ સૌ સભ્યોની ચાર ટીમ બનાવી હતી. નાનાં મોટા સૌને અવનવી રમતોથી બે કલાક વ્યસ્ત રાખ્યાં હતાં. વયસ્ક સભ્યો પાનાની રમતમાં જોડાઈ ગયાં હતાં. ત્યાર બાદ બહેનો અંતાક્ષરીમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. નાનાં બાળકો વોટર પૂલ માં મોજ કરતા થઈ ગયાં હતાં. લગભગ ૩-૧/૨ કલાક વિવિધ રમતો રમ્યાં બાદ સૌ અલ્પાહાર કરવા ભેગા થયાં હતાં. અલ્પાહાર બાદ ફરી સૌ પોતપોતાની ટીમમાં ભેગા થયાં હતાં. સૌ સભ્યોને ફિલ્મ આધારિત રમતો રમાડવામાં આવી હતી. અંતમાં વિજેતાઓને ઇનામથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અંતમાં હાઈ ટી માણીને સૌ પિકનિક નો માણેલ આનંદ ને વાગોળતા વાગોળતા પાછા ફર્યાં હતાં.

શ્રી ક.વી.ઓ.વનિતા વુંદ-બેંગલોર

સંસ્થાના સભ્યો માટે તા. ૪ જુલાઈ ના રોજ મંત્રી મોલ મધે રાખવામાં આવેલ “બોલિંગ” ગેમમા બહેનો એ ઉત્સાહ સભર ભાગ લીધો હતો. ઉપસ્થિત બહેનો ને ત્રણ ટીમોમાં વિભાજીત કરી સૌ “બોલિંગ” ગેમ રમ્યા હતાં. “બોલિંગ” ગેમ રમી સૌ બહેનોએ એ જ મોલ મા રાજધાની હોટલ મધે ભોજન માણી સૌ છૂટ પડ્યા હતાં. શનિવાર તા. ૫-૮-૨૦૧૭ ના રોજ બપોરના ૩ વાગ્યે જાણીતા આર્ટ અને ક્રાફ્ટ એક્સપર્ટ શ્રીમતી શૈલા પ્રસાદનો વર્કશોપ ખૂબ જ સફળ રીતે સંપન્ન થયો હતો. “એન્ટેન્ગલ” જે એક આર્ટ થેરાપી છે તેની રસપ્રદ માહિત આપી હતી. આ થેરાપીનો ઉપયાગ કરી વિવિધ જાતની ડીઝાઈનો કરી સ્ટ્રેસ ને ઓછું કેમ કરી શકાય તે શીખવાડ્યું હતું. બહેનો એ ઉત્સાહ પૂર્વક વર્કશોપમા ભાગ લીધો હતો. ત્યાર બાદ અલ્પાહાર ને ન્યાય આપીને સૌ છૂટા પડ્યા હતાં.

લિ. મંત્રી.

શ્રી ક.વી.ઓ.જૈન સમાજ

ચેન્નઈ

મહિલા મંડળ: તા.૨૨-૦૭-૨૦૧૭ ને શનિવારના મહિલા-મંડળએ જે કાર્યક્રમ નો આયોજન કરેલ. આજની દોડાદોડી અને ટેન્શન ભર્યા વાતાવરણમાં શાંતિ કેવે રાખવી તથા બધીજ પરિસ્થિતિમાં એડજસ્ટ કેવી રીતે થવું એ વિષય પર શ્રીમતી પ્રભાબેન ખીમજી આણંદ, (ગામ-નાનાભડીયા, હાલે-અમાદાવાદ) તથા શ્રીમતી મંજુલાબેન (હાલે- રાજકોટ), આપણને ખુબજ સારી રીતે સમજાવેલ.

તા.૨૩-૦૮-૨૦૧૭ ને શનિવાર ના મિલનની બહેનો અને બાળકો માટે નવરાત્રી પર્વની ઉજવીણી કરવામાં આવેલ. જેમા ૫ વર્ષ થી ૧૨ વર્ષ, ૧૨ વર્ષ થી ઉપરની અપરણિત છોકરીઓ, ૪૫ વર્ષ સુધીની પરણિત બહેનો અને ૪૫ વર્ષ થી ઉપરની મહિલા માટે ગરબા અને રાસના રાઉન્ડ રમાવવામાં આવેલ અને દરેક કેટેગરીમાં ઇનામો આપવામાં આવેલ.

શ્રી કચ્છી મિલન અને શ્રી કચ્છી મિલન ચેરીટેબલ ટ્રસ્ટ

૧. તા.૧૬-૦૭-૨૦૧૭ ના જી એસ ટી ઉપર મુંબઇના નામાંકિત સી.એ. શ્રી જયેશભઈ ગોગરી નો પરીસંવાદ શ્રી કચ્છી ભવનમાં રાખવામાં આવેલ.

૨.તા. ૧૫-૦૮-૨૦૧૭ ને સ્વાતંત્ર દિવસના ઉપક્રમે સવારના ૮-૦૦ વાગે ધ્વજવંદનનો કાર્યક્રમ શ્રી કચ્છી ભવનમાં રાખવામાં આવેલ .

૩.પર્યુષણ પર્વ નિમિતે તા. ૨૬-૦૮-૨૦૧૭ ના સાંજે સામુદયિક પ્રતિક્રમણ શ્રી કચ્છીભવનમાં રાખવામાં આવેલ .

૪.તા.૨૭-૦૮-૨૦૧૭ ના પર્યુષણ પર્વ દરમ્યાન વિવિધ તપસ્યા કરનાર તપસ્વીઓ ના પારણા અને સાંવત્સરીક ક્ષમાપનો પ્રોગ્રામ, શ્રી કચ્છીભવનમાં રાખવામાં આવેલ. તેમજ નિચે મુજબ તપસ્વીઓનું બહુમાન પણ કરાવાં આવેલ.

૧. શ્રીમતી જયના પરીન સવલા સૌભાગ્ય નિદિ તપ અને અક્ષય નિદિ તપમાં ૯ ઉપવાસ

૨.શ્રી અશ્વીન હિરજી છેડા ૧૦ ઉપવાસ (સતત ૨૭ વર્ષ થી અઠાઇ કે વધુ ઉપવાસ)

૩.શ્રીમતી હર્ષાબેન દિલિપ ગાલા ૧૦ ઉપવાસ

૪.શ્રી રાજેશ ગંગાજર મોમાયા ૯ ઉપવાસ

૫.શ્રીમતી અનુપમા રાજેશ મોમાયા ૯ ઉપવાસ

૬.કુ. મિત રાજેશ મોમાયા ૯ ઉપવાસ

૭. શ્રી નેવિલ પ્રકુલ મોત્તા ૯ ઉપવાસ

૮. કુ. ધીતી સંજય લાપસિયા ૯ ઉપવાસ

૯. શ્રી સુનીલ ફતેચંદ ગડા ૯ ઉપવાસ

૧૦. શ્રી કિરણ વલ્લભજી દેહિયા ૯ ઉપવાસ (સતત ૨૭ વર્ષ થી અઠાઇ કે વધુ ઉપવાસ)

૧૧. કુ. નેહલ પંકજ ગડા ૯ ઉપવાસ

૧૨. શ્રી હિરેન ચંમપક વિક્રમ ૯ ઉપવાસ (સતત ૧૭ વર્ષ થી અઠાઇ કે વધુ ઉપવાસ)



®

Tip-Top

SHREE CHANDAN CORPORATION

Dealers in : Spices, Dry Fruits & Kirana etc.,

190, Sri Krupa Market, Malakpet, Hyderabad-36. (T.S.)
email: chandantiptop@gmail.com



Office Phones: 040 - 24553311, 24554411, 24555511

Deepak Jadavji Nagda (Dumra) - 9246821717
Sachin Kantilal Gosar (Halapar) - 9246825959

Ravindra Nanji Gosar (Halapar) - 9246354561
Sameer Manilal Gadda (Sabhrai) - 9246821919

Prop: **DISHANT GALA**

330 ml

250 ml



RED BULL GIVES YOU WINGS.

Shri Mahaveer Agencies

Bank Road, GADAG. Cell : 9986513052

૧૩. શ્રીમતી હેમલતા ચંપક વિક્રમ	૮ ઉપવાસ (સતત ૮ વર્ષ થી અઠાઇ કે વધુ ઉપવાસ)
૧૪. શ્રી સંજય કલ્યાણજી લાપસિયા	૮ ઉપવાસ
૧૫. કુ. ફીઓના દિનેશ દેઢિયા	૮ ઉપવાસ
૧૬. કુ. કોમલ કેરણ સાવલા	૮ ઉપવાસ
૧૭. શ્રી. પંકજ શશીકાંત વિરા	૮ ઉપવાસ
૧૮. ડો. નયનાબેન વોરા (મહેમાન)	૮ ઉપવાસ
૧૯. શ્રી. જયેશ કાનજી ધરોડ	કુલ ૬૫ વર્ષમાન તપ માં ટોટલ ૨૭૭૫ આયંબિલ
૨૦. શ્રીમતી સ્વાતી જયેશ ધરોડ	કપાય તપ
૨૧. શ્રીમતી જયવંતી રમણીક સાવલા	સમવસરણ તપ (૪ થો વર્ષ)
૨૨. શ્રીમતી વાસંતી રમેશ ગોસર	અક્ષયનીધી તપ (૩ જો વર્ષ)
૨૩. કુ. પરિતા નિતિન ગંગર	અક્ષયનીધી તપ (૩ જો વર્ષ)
૨૪. શ્રી. લોકાંક્ષી લેનિન અજાણી	અક્ષયનીધી તપ (૨ જો વર્ષ)

૫. શ્રી કચ્છી મિલન ચેરીટેબલ ટ્રસ્ટ , શ્રી કચ્છી મિલન અને શ્રી ચેન્નઈ કે. વી. ઓ જૈન સમાજ ની આમાન્ય સભાઓ તેમજ કારોબારી સભ્યોમે ચુટણી તા :- ૨૪-૦૯-૨૦૧૭ ના યોજાયેલ જેમાં નીચે મુજબ સભ્યો ચુટાયેલ .

શ્રી કચ્છી મિલન ચેરીટેબલ ટ્રસ્ટ બોર્ડ

૧. શ્રી અરવીંદ ગાંગજી દેઢિયા	ચેરમેન
૨. શ્રી હસમુખ ખીમજી સંગોઇ	મંત્રી
૩. શ્રી યોગીન શાંતિલાલ છેડા	ખજાનચી
૪. શ્રી દિનેશ ધનજી દેઢિયા	સભ્ય
૫. શ્રી બરત વલ્લભજી દેઢિયા	સભ્ય
૬. શ્રી દિપક વાલજી છેડા	સભ્ય
૭. શ્રી દિલીપ રમણીક દેઢિય	સભ્ય

શ્રી ચેન્નઈ કે. વી. ઓ જૈન સમાજ કમિટી :

૧. શ્રી વશનજી વીરજી ગંગર	પ્રમુખ
૨. શ્રી ભાવેશ રાયચંદ ગોગરી	મંત્રી
૩. શ્રીમતી રમિલા કાંતીલાલ વીરા	સભ્ય
૪. શ્રી મુકેશ કાંતીલાલ બૌવા	સભ્ય
૫. શ્રી લક્ષ્મીચંદ ભવાનજી સાવાલા	સભ્ય
૬. શ્રી સુરેન્દ્ર તલક્ષી ગોસર	સભ્ય
૭. શ્રી નીતીન નેમજી ગંગર	સભ્ય
૮. શ્રી પંકજ ધનજી ગડા	સભ્ય
૯. શ્રી દિનેશ મોરારજી સૈયા	સભ્ય

શ્રી કચ્છી મિલન કમિટી

૧. શ્રી નિખિલ રમણિક છેડા	પ્રમુખ
૨. શ્રી કેવીન ધીરજ સાવલા	મંત્રી
૩. શ્રી હિતેશ વશંજી ગંગર	ખજાનચી
૪. શ્રી સંદિપ વીસનજી સંગોઇ	ઉપ મંત્રી
૫. શ્રી ચેતન પ્રકુલ દેડિયા	સભ્ય
૬. શ્રી અમિત જયોતિન્દ્ર લાપસીયા	સભ્ય
૭. શ્રી ધીર દિલીપ દેડિયા	સભ્ય
૮. શ્રી યોગેશ હરીશ ભેદા	સભ્ય
૯. શ્રી જીગર અરૂણ વિક્રમ	સભ્ય
૧૦. શ્રી રાજેશ હિતેશ ગોગરી	સભ્ય

૬. તા ૧૭-૦૯-૨૦૧૭ ના શ્રી કચ્છીભવનમાં સ્વામીવાત્સલ્ય જમણ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧૦મી, ૧૨મી તથા ઉચત્તર ફાઇનલ પરિક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવેલ.

૭. તા ૨૧-૧૦-૨૦૧૭ ના દીવાળી અને નુતન વર્ષના ઉપલક્ષમાં રંગારંગ સંગીત-સંધ્યાનું આયોજન કચ્છીભવનમાં આવેલ. ચાર ટીમો બનાવવામાં આવેલ. આ ઉપરાંત ફોટો શુટનો પ્રોગ્રામ હતો. સાથે સ્વાદિષ્ટ સાઉથ ઇંડીયન ભોજન સંતોષ બધાયે માણ્યો.

૮. તા ૨૯-૧૦-૨૦૧૭ ના રાહતના દરે મિલનના સભા માટે માસ્ટર હેલ્થ ચેક-અપ નો મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ.

શ્રી ક.વી.ઓ.જૈન સમાજ

કચ્છી વિસા ઓસવાલ જૈન સમાજ હૈદરાબાદના રજતજયંતી વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણીનો અહેવાલ

કચ્છી વિસા ઓસવાલ જૈન સમાજ - હૈદરાબાદ સ્થાપના ને ૨૫ વર્ષ પૂર્ણ થતા રવિવાર તા ૦૯.૦૭.૨૦૧૭ ના કચ્છીભવન હૈદરાબાદ મધે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત નવકારમંત્રના સ્મરણ અને રાષ્ટ્રગીતથી કરવામાં આવી ત્યાર બાદ વિવિધ શહેરોથી પધારેલ મહેમાનો તથા પદાધિકારીઓ દ્વારા દીપ પ્રજ્જ્વલન કરવામાં આવ્યું. પ્રમુખશ્રી નીતિનભાઈ ધરોડ ઉપસ્થિત સર્વેને આવકાર આપી સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે સંક્ષિપ્તમાં પ્રકાશ પાડેલ. આ કાર્યક્રમ માટે મુંબઈથી ખાસ બે વક્તાઓને આમંત્રણ આપવામાં આવેલ. પ્રથમ વક્તા શ્રી નિલેશભાઈ ગાલા એ “જનરેશન ગેપ” વિષય પર ૩૦ મિનીટ પોતાનું વક્તવ્ય વિસ્તારપૂર્વક આપેલ, જેને શ્રોતાઓએ મંત્રમુગ્ધ થઈને માણેલ, બીજા વક્તા શ્રી અનુલભાઈ ભેદા એ “સમાજની ઘટતી જતી વસ્તી એક મહાસમસ્યા” વિષય પર ૪૦ મિનીટ સુધી પોતાના મંતવ્યોની રજૂઆત કરેલ. આ વિષય પર એમના સંશોધન-દાખલાઓ સહિત વક્તવ્ય શ્રોતાઓએ ખુબજ રસપૂર્વક માણેલ.

ચેન્નઈથી આમંત્રિત દક્ષિણ ભારત ક વિ ઓ જૈન એકમના સ્થાપક વડીલ શ્રી કલ્યાણજીભાઈ સૈયા તથા ચેન્નઈ સમાજના પ્રમુખ શ્રી વિશનજીભાઈ ગંગર તેમજ મુંબઈથી આપણા હૈદરાબાદ સમાજના લોકલાડીલા વડીલ એવા શ્રી ધનજી લખમશી સાવલા મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમમાં હાજરી આપી હતી આ સૌ મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરી સંસ્થાના પદાધિકારીગણ તથા બોર્ડ મેમ્બર્સને અભિનંદન આપેલ. આ પ્રસંગે કચ્છી વિસા ઓસવાલ જૈન સમાજ - હૈદરાબાદ તરફથી સમગ્ર તેલંગાણા-આંધ્રપ્રદેશના સભ્ય પરિવારોને આવરી લેતા આકર્ષક-માહિતીસભર દરેક સભ્યોના ફોટાઓ સહિતનું વસ્તીપત્રકનું વિમોચન કાર્યક્રમના મુખ્ય અતિથિ કચ્છથી ખાસ પધારેલ માંડવી-મુંદ્રા વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી લોકલાડીલા શ્રી તારાચંદભાઈ જગશી છેડાના વરદ હસ્તે કરવામાં આવ્યું, આ પ્રસંગે વસ્તીપત્રકના મુખ્યદાતા શ્રી ધનજીભાઈ લખમશી સાવલાનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત ઉપસ્થિત દરેક મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત જાહેરાતોના દાતા તથા વસ્તીપત્રક સમિતિના સહયોગને બિરદાવવામાં આવેલ.

મુખ્ય અતિથિ શ્રી તારાચંદભાઈ છેડાએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું કે હૈદરાબાદની આ પ્રથમ મુલાકાતમાં હું હૈદરાબાદમાં વસતા કચ્છી સમાજથી ખૂબજ પ્રભાવિત થયો છું, કચ્છથી ૨૦૦૦ કિલોમીટર દૂર રહીને પણ હૈદરાબાદમાં કચ્છ જેવું વાતાવરણ જોઈ ખૂબજ આનંદની લાગણી અનુભવું છું, અહીં વસતા કચ્છી સમાજની પ્રગતિ અને એમના દ્વારા ચલાવતી જાહેર પ્રવૃત્તિઓ ખરેખર અભિનંદનીય છે, કચ્છમાં ભૂકંપ બાદ નવનિર્માણ પામેલું કચ્છ પણ ખુબજ પ્રગતિ પંથે છે, આપસૌ પરિવારો પણ કચ્છને ન ભૂલતા, પરિવાર માંથી એક સભ્યને કચ્છ સ્થિર થવા પણ વિનંતિ કરી હતી અને કચ્છમાં પોતાના તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

સંસ્થા તરફથી મુખ્ય અતિથિ શ્રી તારાચંદભાઈ છેડાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૧૧ વર્ષના બાળક આર્ય સંકેત મુકેશ ધરોડની ઉપલબ્ધિઓને ધ્યાનમાં રાખી આ વર્ષના “ક વિ ઓ કે સિતારે” નું એવોર્ડ અર્પણ કરવામાં આવેલ, ઉપરાંત હૈદરાબાદ લગ્નપ્રસંગે આવતા મુંબઈમાં વસતા એક પરિવારનું હૈદરાબાદ થી ૨૦૦ કીલોમીટર દૂર ગમખ્વાર અકસ્માતમાં ૫ જણનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું જેમાં ફક્ત એક વર્ષની બાળકીને ગંભીર ઇજાઓ થતાં ત્યાંના રહેવાસી શેખ મહમદ આ બાળકીને બચાવી લેવા તાત્કાલિક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી સારવાર માટે હૈદરાબાદ હોસ્પિટલમાં પહોંચાડી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડેલ, આ પ્રસંગે શેખ મહમદનું પણ ખાસ સન્માન કરવામાં આવેલ. સમૃત્તિચિહ્નના દાતા શ્રી ગૌરાંગ નેમજી ધરોડનું પણ સન્માન કરવામાં આવ્યું.

આ સંપૂર્ણ કાર્યક્રમના સંચાલન માટે ખાસ મુંબઈથી પ્રા. ડો. ગુલાબભાઈ દેઢિયાને આમંત્રવામાં આવેલ જેમણે પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમનું ખૂબજ સરસ સંચાલન કરેલ. એમનું પણ સન્માન કરવામાં આવેલ. અંતમાં માનદ મંત્રી શ્રી કિરણ રાંભિયાએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરેલ, આ પ્રસંગે ઉપસ્થિત સર્વે સભ્યો માટે ડીનરનું આયોજન કરવામાં આવેલ, સમાજના દરેક સભ્ય પરિવારોને વસ્તીપત્રક સાથે યાદગીરીરૂપે સ્મૃતિચિહ્ન આપવામાં

આવેલ, ત્યારબાદ મનોરંજન માટે પ્રખ્યાત કમલ- ટીનાના સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામન્ય કારોબારી સભાનો એહવાલ:

તા ૧૬.૦૭.૨૦૧૭ ના સામન્ય કારોબારી સમીતી ની એક સભા રાખવામાં આવેલ, તે સવારના ૧૦ વાગે સભા ચાલુ કરવામાં આવેલ, પ્રમુખશ્રી નીતિનભાઈ ધરોડ એ બદા સભ્યોને અવકાશ અને આ બે વર્ષ દરમ્યાન આપણી કારોબારી સમીતી વતી કઈ ભૂલચૂક થયી હાયે તો મિચ્છામી દુઃખ કહેલ, સાથે કહેલકે કરછી મિત્ર મંડળ દ્વારા આયોજીત સ્વામીવાસ્તવ્ય નું લાભ આપણી સંસ્થા ને મળેલ તો બદા સભ્યોને જાણ કરેલ લાભ લેવા વિનીતી કરેલ.

નવી કારોબારી સમીતી ના નામ આ મુજબ છે: ૧) શ્રી નીતિનભાઈ ધરોડ (પ્રમુખ) ૨) શ્રી પોપટભાઈ છેડા (ઉપપ્રમુખ) ૩) શ્રી કિરણભાઈ રાંભીયા (માનદ મંત્રી) ૪) શ્રી હરેશભાઈ દેઢિયા (સહ મંત્રી) ૫) શ્રી મનોજભાઈ સાવલા (ખજનચી) કારોબારી સભ્યો ૬) શ્રી ચીમનભાઈ ગાલા ૭) શ્રી તારાચંદભાઈ ધરોડ ૮) શ્રી મણીલાલભાઈ ધરોડ ૯) શ્રી રતિલાલભાઈ છેડા ૧૦) શ્રી નેમચંદભાઈ ગાલા ૧૧) શ્રી શાંતિલાલભાઈ માડુ ૧૨) શ્રીમતી નિશાબેન નીતિન ધરોડ ૧૩) શ્રીમતી આશા કિરણ રાંભીયા.૧૪) શ્રી વસંતભાઈ ગાંગજી સાવલા

સવત્સરી જમણ નો એહવાલ:

કરછી વિસા ઓસવાલ જૈન સમાજનો સીલ્વેર જુબલી વર્ષ હોતા આખો વર્ષ કંઈક નવા કાર્યક્રમ કરવો અમે કારોબારી સમીતીએ નક્કી કરેલ, શ્રી કરછી મિત્ર મંડળ આયોજીત સ્વામીવસ્તવ્યના જમણનો લાભ આપણી સંસ્થાએ લીધેલ આ કાર્યક્રમ તા.૨૭.૦૮.૨૦૧૭ના રવિવાર ના કરછી ભવન મધ્યે રાખવામાં આવેલ, ત્યાં તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું, કરછી મિત્ર મંડળના સભ્યો પરિવાર ટોટલ ૧૭૨૫ જણાએ જમણવારનું લાભ લીધેલ. આ કાર્યક્રમમાં પણ અન્ય પેટા સંસ્થાના ઉત્સાહિત કાર્યકરોના આભારી છીએ, જેમનો જમણવાર દરમ્યાન અમને સારો સાથ મળ્યો તે માટે નીમ્ન લીખીત દરેક સંસ્થા ના આભારી છીએ.

- | | |
|--------------------------------------|---------------------------------|
| (૧) શ્રી ગુણ ગુલાબ મહિલા મંડળ | (૨) શ્રી શાંતિ ગુણ મહિલા મંડળ |
| (૩) શ્રી શાંતી શ્રાવિકા સ્નાત્ર મંડળ | (૪) શ્રી શાંતી સ્નાત્ર સખી મંડળ |
| (૫) શ્રી ક વિ ઓ યુથ ગ્રુપ | (૬) કરછી દસા ઓસવાલ યુથ ગ્રુપ |
| (૭) શ્રી કરછી ગુજર જૈન પરિવાર. | |

યુથકેમ્પનો અહેવાલ

દક્ષિણ ભારત આયોજીત યોઉથ કમ્પ નો તા.૦૨.૦૬.૨૦૧૭ના દાંડેલી ખાતે રાખવામાં આવેલ, જે આપણી સંસ્થાના વતી ૨૮ યુવક યુવતીઓ સાથે ૨ વોલિન્ટોર શ્રીમતી આશા રાંભીયા અને શ્રીમતી ઉષા સાવલા બાગ લીધેલ. ત્યાં દક્ષિણ ભારત ની એક કારોબારી સભ્યોની મીટીંગ હોતા હૈદરાબાદ વતી ૫ કારોબારી સભ્યોએ ભાગ લીધેલ.

શ્રી ક.વી.ઓ.જૈન સમાજ

ઉત્તર કર્નાટક

૧. હુબલી

દાંડીયા અને ગરબાની રણકાર સાથે ને કચ્છની અવનવી વાનગી હરિફાઈ (Competition) સાથે. આઘાઢી બીજની કચ્છી મહીલા મંડળે જોરદાર ઉજમણી કરી. મિઠાઈ બનાવાની હરિફાઈ માં 1st Prize સૌ. જયશ્રી સચીન ગોગરી ને મલ્યું. પર્યુષણ પર્વનાં ધર્મની સારી આરાધના થઈ પોથી પધરાવવાનું ધી શ્રી વિરેંદ્ર દામજી છેડાએ લિધેલ. 15th August સ્વાતંત્ર દિન નિમિત્તે નાના છોકરાઓ માટે Competition રાખેલ. એમા છોકરાઓ દેશ માટે બલીદાન આપનાર શુરવીરોના પાત્રો, બખુબી થી નિભાવ્યા. કાર્યક્રમ પછી અલ્પાહારની વ્યવસ્થા જયશ્રી સચીન ગોગરી અને સ્નેહા ભાવીન ગોગરી તરફથી હતું. શ્રી ભગવતી મહાકાલી મંડળ સંચાલીત, ૨૧ મી નવરાત્રી ઉત્સવ અત્યંત ઉમંગ અને ભાવથી ઉજવાયો. આ ઉત્સવમાં નવેનવ દિવસ ના મુખ્ય દાતા હતા શા. વિરેંદ્ર દામજી છેડા અને શ્રીમતી ગીતાબેન નો સન્માન સૌ. ચેતના એ કિધેલ. September 16-19 DBKVO Senior Citizen Group, મહાબળેશ્વરની મોજમજા 15 Couple, હુબલી, બિજાપુર, હૈદરાબાદ, મધુરાઈ, બેંગલોર, ચેન્નઈ થી આવી – સાથે માળી ૪ દિવસ નિર્સંગ અને કુદરતનો ખુબજ આનંદ લિધો. આ Senior Citizen Group ને “દક્ષિણ ભેડપો” નામ આપવામાં આવ્યો છે.તા. 1st October 2017, ના

દિવસે શ્રી. વિરેન્દ્ર દામજી છેડા પરિવારે બીજાપુરમાં નુતન કચ્છીભવન “માતૃશ્રી વિજિયાબાઇ દામજી નામે “વિજિયા ભવન” ના ઉદ્ઘાટન માટે હુબલી થી ૨ બસ ઝાતિ બંધુવોને લઇ જવાનો લાભ લિધેલ સંપુર્ણ વ્યવસ્થા નો ખર્ચ પોતે કરેલ. 1st November 2017, ના કર્ણાટક રાજોત્સવ ઉપલક્ષમાં જિન કુશલ મહિલા મંડળ, સંભવનાથ મહિલા મંડળ, સિવાંચી મહિલા મંડળ તથા રાજસ્થાન પત્રીકા હુબલી, ધારવાડ, ગદગ જૈન છોકરાઓ માટે નૃત્ય, ગીતનું અસાધારણ પ્રતિભા(Talent Competition) પ્રતીયોગીતાનું આયોજનમાં ભાગ લિધેલ. આવું Competition હુબલીમાં પહેલી વાર થયું હતું. આ Competition ના નિર્ણાયક શ્રીમતી ગીતા વિરેન્દ્ર છેડા, નિકિતા અને રાખી કોરીઓગ્રાફર હતા.

14th November 2017, ના દિવસે, મહિલા હિતવર્ધક મંડળ તરફથી “Children’s Day Celebration” રાખવામાં આવ્યું હતું અને Dress Competition માં 1st Prize કુ. કિશા ભાવીન ગોગરી ને મળ્યો.

ગીતા વિરેન્દ્ર છેડા

શ્રી ક.વી.ઓ.જૈન સમાજ

૨. બીજાપુર

દક્ષિણ ભારત ક.વિ.ઓ એકમ માટે એક ગૌરવ ભર્યો અવસર છે. ઉત્તર કર્નાટક ઘટકના બીજાપુરની પાવન ધરા પર નવ્ય, ભવ્ય, નયનરમ્ય કચ્છીભવનનું નિર્માણ થયું. કર્ણાટકની ધરા પર આ સૌ પ્રથમ “કચ્છીભવન” છે. બિજાપુર જ્યાં કચ્છીઓના ફક્ત ૪૫ ઘર છે એવા નાના સમુહમાં આન ભવ્ય ૨૫૦૦૦ કુટનો કચ્છીભવન, ઉપાશ્રય સાથે નિર્માણ કરવું એ કોઈ સહેલી વાત નથી. કર્ણાટક સૌ પ્રથમ કચ્છીભવનનું નિર્માણ કરવાનો ભગિરથ કામ બિજાપુર કચ્છી સમાજએ કરી એ મીસાલ ઉભી કરી છે.

૨૦૦૪ ની સાલમાં સૌ પ્રથમ સૈલેશ ખેતશી સાવલા ત્યાં મણિકાંત તેજસી ગોગરી એ સરકારી ૭૪૦૦ કુટ ખાલી જગ્યા માટે જાણ કરી તેમના ત્યાં સ્વ. હરખચંદ નાનજી વીરા તેમજ સ્વ. દામજી માલશી રાંભિયાના મહેનતથી જગ્યા સમાજને મળી. ૨૦૧૩ ની સાલમાં આપણા પ્લોટના લગભગ ૭૫૦૦ કુટની જગ્યા રાજુ(હિરેન) પ્રેમજી છેડાએ બી. ડી.એ ચેરમન લક્ષ્મિકાંત હદનુરના સહકારથી જગ્યા સમાજને અપાવી.

બિજાપુરના પુષ્પોદયે પુ.મુનિવર દેવરત્નસાગરજી મ.સા. ના પુનીત પગલા અમારા ગામમાં થયા. ૬ વર્ષ પહેલાં બિજાપુર પધારવાનો સુવર્ણ અવસરનો લાભ મળ્યો. જેમને જાણ થઈ કે બિજાપુર સમાજ પાસે એક જગ્યા કચ્છી ભવનના નિર્માણ માટે ખરીદી કરેલ છે. તરતજ તેમને સર્વોને ભેગા કર્યા પણ નાનકડી સમાજને ભવન બાંધવાની હીમ્મત નથી થતી એવી જાણ કરી પણ તેમના આર્શીવાદ અને પ્રેરણાથી તરતજ રૂ. ૬૧ લાખનો ભાંડોળ તો થયો અને બાકીના આર્થિક ભાંડોળ માટે પ્રોત્સાહન આપ્યો. ભુમીપુજન સાથે ખાત મુહુર્ત પણ તેમની નીશ્રામા કરાવામાં આવ્યો. પણ વીધીના વકતાએ પૂ. દેવરત્નસાગરજી મા.સા ટુંક સમયમાજ કાળધર્મ પામ્યા. અમારા ઉપર એક સંકટ આવી ગયો આગળ શું થશે?

આજ સમયમાં વિહાર કરતા મુનીશ્રી જગવલ્લભસાગરજી મ.સા બીજાપુર પધારવાનો થયો અને તેઓ કચ્છી ભવનના નિર્માણ કાર્ય માટે આચાર્ય ભગવંત કલાપ્રભાસાગરસુરીશ્વરજી મ.સા પાસે મળવાના સુચન કર્યો આચાર્ય ભગવંત સમેત મુંબઇમાં મળ્યા. સમાજના અંતરમાં ભવન નિર્માણ કાર્યની ધગશ હતી. ઉદ્ભવેલ પરિસ્થિતિમાં તેમને જાણ કરી. આચાર્ય ભગવંત અમારા માટે હીમ્મત, માર્ગદર્શક, દિશા અને પંથના પ્રેરક બન્યા. દાનપમની યોજન કરી આપી અને મુંબઇ ત્યાં કચ્છમાં જ્યાં જ્યાં સાધુ, સાધ્વીજીના ચાતુર્માસ હતા ત્યાં દાનપજોની બુકો અપાવી તથા મુંબઇના દાનવીર શ્રેહીઓને પરિચય કરાવી સારો સિંહ ફાળો મેળાવી આપવામાં પ્રેરક બન્યા. સૌ પ્રથમ નવનીત પરિવાર પાસે ગયા ત્યાં શ્રી ગણેશ કર્યો તેમજ આરતી ગ્રુપના ભાઇશ્રી ચંદ્રકાંતભાઇએ પણ સારો ફાળો આપ્યો.

શુરુવાતમાં ફક્ત ૧૦૦૦૦ કુટની જગામાં કચ્છીભવનનું નિર્માણનો લક્ષ હતો. પણ ફાળામાટે મુંબઇ, મહારાષ્ટ્ર, સાઉથમાં ગયા ત્યાં દાનવીરોએ ઉદાર દિલથી દાનની ગંગા બહાવી રોએ ઉદાર અમારો ઉત્સાહ વધાર્યો. પહેલા જ ૧૦૦૦૦ કુટની જગામાં કચ્છીભવનની યોજના હતી તે બદલાવીને ૨૫૦૦૦ કુટની વીશાળ બાંધકામમાં ઉપાશ્રય સાથે

આવાસ ની યોજન પણ કરવામા આવી.

પહેલાથી અમોએ નિર્ધારીત કરેલ કે કચ્છીભવન ઉપર બને ત્યા સુધી ઉત્તર કર્ણાટકના વડીલ શેઠ શ્રી દામજી જાધવજી છેડા હુબળીવાળાનો નામ રાખવુ. આ લક્ષ ધ્યાનમા રાખી અમો હુબળી શ્રી વીરેદ્રભાઈ ત્યા ગીતાબેન પાસે ગયા અને તેમને આ વાતની પ્રસ્થાવના કરી. તેઓ એ અમારા પ્રસ્થાવના ઉપર સજી મુરીદ દર્શાવી તરતજ પોતાના માતુશ્રીનો નામ ભવન માટે આવ્યો અને રૂ. ૪૧ લાખનો સિંહફાળો અમોને અર્પણ કર્યો.

દક્ષીણ ભારત એકમની કીમ્મતની જાણ અમોને અનુભવી ચેન્નાઈ વડીલ શ્રી વીસંજીભાઈ ગંગર, શ્રી કલ્યાણજીભાઈ સૈયા, પૂ. પ્રફુલભાઈ ભેદા ત્યા કાંતીભાઈ સૈયા. બેંગલોરમા કીરણભાઈ ગાલા, ધીરજભાઈ નાગડા ત્યા હૈદરાબાદમા શ્રી રાહુલભાઈ સંગોઈ, શ્રી શાંતીલાલભાઈ મામણીયા, મદુરાઈમાં નિતીનભાઈ, રમણિકભાઈ એ પોતાનો અમુલ્ય ટાઇમ આપી અમોને ચેન્નાઈ ત્યા મદુરાઈમા સારો ફાળો અપાયો. તેમજ મહારાષ્ટ્ર એકમના કોલ્હાપુરના શ્રી દામજીભાઈ છેડા, હરખયાંદભાઈ ગાલા, સાંગલીના જેઠાલાલભાઈ છેડા, ચંદ્રકાંતભાઈ માલદે, નીલચભાઈ નાગડાએ પોતાનો સમય આપી સારો ભંડોળચ ઉભિ કરી આપ્યો. ફાળામાટે મુંબઈના શ્રી કમલેશભાઈ ગડા, શ્રી ઠાકરશીભાઈ ગડા, શ્રી નેમચંદભાઈ ગાલા, શ્રી દીલીપભાઈ ગાલ તેમજ સોલાપુરના કેતનભાઈ મહેંદ્ર નીસર ચવતમાલના શ્રી ગીરીશભાઈ સવલા છીંદવાડાના શ્રી મનોજભાઈ કક્કા, નાગપુરમા શ્રી કલ્યાણજીભાઈ સતરા, દીપકભાઈ ભેદા, ભરતભાઈ ગંગરનો સારો સહકાર અમોને મળ્યો.

ભવનનો વાસ્તુપુજન સાધવી શ્રી પ.પૂ. સચંમગુણાશ્રી આદી ઠાણા પ ની નિશ્રામા થયો. બીજાપુર સમાજનો એક લક્ષ છે કે ભવનની જે પણ આવક થસે તેમાથી ૩૦% મેટેનન્સ માટે રાખી બાકીની રકમ કચ્છી જરૂરીયાત ભાઈઓના આવાસ, મેડીકલ ફાળવવામા આવશે. તા ૧ ઓક્ટોબર ૨૦૧૭ ના પાવન દિવસે સમાજના શ્રેણીયોના નિશ્રામા શ્રી વીજયા કચ્છીભવનનો લોકાર્પણ વીધી થઈ.

લી. શ્રી. રજનીકાંત તેજસી ગોગરી .

શ્રી ક.વી.ઓ.જૈન સમાજ

૩. ગદગ

શ્રી કચ્છ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાય ના તપશ્ચિવર્ય ગુરુદેવ પરમપૂજ્ય શ્રી ધીરજલાલજી સ્વામીના શિષ્ય, વ્યશનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય શ્રી નરેશમુનિજી "આનંદ" તથા પરમપૂજ્ય ઓજશમુનિ " મંગલ" નું સન૨૦૧૭નું ચાતુર્માસ ગદગ કર્ણાટકમાં શ્રી કચ્છી દશા ઓસ્વાલ જૈન મહાજન વાડીમાં શ્રી કચ્છી દશા ઓસ્વાલ જૈન મહાજન, તથા શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના સહયોગ થી સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી "માતુશ્રી જવેરબાઈ વીરજી પાલન ગાલા પરિવાર, ગામ કચ્છ ભોજાય હાલે ગદગ.પરિવારે" ચાતુર્માસ કરાવ્યું.

"આનંદ-મંગલ" ચાતુર્માસ ૨૦૧૭ ની ઝલક

તારીખ.૫-૬-૨૦૧૭ ના પૂજ્ય ગુરુદેવોનું પરમપૂજ્ય ગુરુદેવ શ્રી જગવલ્લભસાગરજી મહારાજ સાહેબ સાથે નગર પ્રવેશ. તારીખ.૨૫-૬-૨૦૧૭ ના પૂજ્ય ગુરુદેવોનું શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના સ્થાનક ભવન થી શ્રી કચ્છી દશા ઓસ્વાલ જૈન મહાજનવાડીમાં વાજતે-ગાજતે પ્રવેશ. પ્રવેશમાં મુંબઈ,કચ્છ,હુબલી,બાગલકોટ,કોપલ,હૈદરાબાદ,ચૈન્નાઈ, કોલકાતા,ટાટાનગર થી મહેમાનો પધારેલ અને લગભગ ૧૧૦૦ ભાવિકો એ ભાગ લીધેલ.

તારીખ, ૧૦-૭-૨૦૧૭ ના ચાતુર્માસ પ્રારંભ - ૪૮ દીવશ નો ભક્તામર તપ નો એકાસના સાથે પ્રારંભ, ભક્તામર તપમાં ૪૨ તપશ્ચિ આ તપમાં જોડાયા, એકસના સંઘને રસોડે હતા.

તારીખ,૨૭-૭-૨૦૧૭ ના અઢાર પાપસ્થાનક ની ભાવયાત્રા નું ભવ્ય આયોજન થયું

તારીખ.૩૧-૭-૨૦૧૭ ના પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજલાલજી સ્વામી ની પુણ્ય તિથિ નિમિતે પારિવારિક જાપનું આયોજન.

તારીખ. ૧-૮-૨૦૧૭ થી ૫-૮-૨૦૧૭ સુધી પાંચાણીકા મહોત્સવ નું આયોજન

a)૧-૮-૨૦૧૭ ના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદા ની ૧૦૩ મી વર્ષગાંઠ નિમિતે અઢાર અભિષેક,

b) ૨-૮-૨૦૧૭ ના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદા જિનાલાય ની ધજા મહોત્સવહ .

c) ૩-૮-૨૦૧૭ ના ભક્તામર મહાપૂજન અને રાતના શ્રી સીમુંધર સ્વામીની ભાવયાત્રા

d) ૪-૮-૨૦૧૭ ના ગૌતમસ્વામી મહાપૂજન

e) ૫-૮-૨૦૧૭ ના ચી.દેવાંશ ગુંજન ગાલા ના બીજા જન્મદિવસ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન નું આયોજન થયેલ, પંચાનિકા મહોત્સવમાં વિધિકાર મુંબઈ થી રાજનંદુ પધારેલ ખુબજ સુંદર અને આનંદ ઉલ્લાશ થી પંચાનિકા મહોત્સવ ઉજવાયો,

તારીખ.૧૯-૮-૨૦૧૭ થી ૨૬-૮-૨૦૧૭ પર્યુષણ મહાપર્વ ખુબજ સરસ રીતે ઉજવાયું પર્યુષણ દરમિયાન તપશ્ર્યા તથા બીજી ધાર્મિક આરાધના પણ સારા પ્રમાણમાં થયેલ અને સામુહિક સાવંત્સરિક ક્ષમાપના નો કાર્યક્રમ નું આયોજન ખુબજ આનંદ ઉલ્લાશ થી થયું

તારીખ.૨૦-૯-૨૦૧૭ થી પંદર દિવસીય આયંબિલ સાથે સિદ્ધ તપનું આયોજન તથા યંબિલ ની ઓલી માં કુલ ૩૦ જન તપસ્વી ભાગ લીધેલ

તારીખ.૨૪-૯-૨૦૧૭ ના પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નરેશમુનીજી "આનંદ"નું ૬૦ માં જન્મદિવસ નિમિત્તે "રક્તદાન" શિબિર નું આયોજન થયેલ અને રાતના નાટિકા નું આયોજન થયેલ રક્તદાન શિબિર માં ૭૨ થી વધારે વ્યક્તિઓ એ ભાગ લીધેલ દિવાળી પર્વમાં શેષ કાર્યક્રમ નું આયોજન.

તારીખ. ૧૮-૧૦-૨૦૧૭ ના કાળી ચૌદસ ના સર્વશાન્તિ સન્તીકર્મ નું અનુસ્થાન

તારીખ. ૧૯-૧૦-૨૦૧૭ ના દિવાળી ના સમૂહ યોગ પૂજન નું આયોજન

તારીખ.૨૦-૧૦-૨૦૧૭ ના નૂતન વર્ષ ના ગોઉતમસ્વામી જીવન ચરિત્ર તથા મહામંગલિક કાર્યક્રમ નું આયોજન ખુબજ સારી રીતે થયેલ સારી સંખ્યામાં ભાગ લીધેલ .

તારીખ.૨૪ -૧૦-૨૦૧૭ ના જ્ઞાન પાંચમ ના સરસ્વતી મહાપૂજન નું ઓડિયો વિઝલ સાથે અનોખા અંદાજ માં કાર્યક્રમ નું આયોજન થયેલ

તા.૨૯-૧૦-૨૦૧૭ ના વડીલ વંદનાવળી નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ અને તેમાં ૩૦ થી વધુ પરિવારો ભાગ લીધેલ .

તારીખ.૨-૧૧-૨૦૧૭ ના ચાતુર્માસ અભિવાદન સમારોહ તથા સન્માન કાર્યક્રમ નું આયોજન થયેલ

તારીખ ૪-૧૧-૨૦૧૭ ના ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્ય ગુરુદેવો ચાતુર્માસ પરિવર્તન કરી પ્રથમ વિહાર પંકજભાઈ વીરજી ગાલા ના ઘરે થયેલ.

તારીખ.૬-૧૧-૨૦૧૭ ના માતૃશ્રી જેઠીબાઈ ખીમજી વીરા ના ઘરે, તારીખ.૭-૧૧-૨૦૧૭ ના શાંતિલાલજી પલરેયાના ઘરે તારીખ.૮-૧૧-૨૦૧૭ના જીવન સંઘ્યા વૃદ્ધાશ્રમમાં, તારીખ.૯-૧૧-૨૦૧૭ ના વિજયરાજજી બાગમારના ઘરે, તારીખ.૧૦-૧૧-૨૦૧૭ ના શા પ્રવીણચંદ લાલજી લુધીયાના ગરે પગલાં કરી સ્થાનક ભવનમાં પધારેલ, તારીખ.૧૨-૧૧-૨૦૧૭ ના કોપલ તરફ વિહાર ગુરુદેવ ના પ્રથમ વિહાર માં લંકુન્દી સુધી ૧૦૦ શ્રાવક શ્રાવિકા ઓ એ ગુરુદેવ સાથે વિહાર કરેલ.

પૂજ્ય ગુરુદેવ ચાતુર્માસ ના વ્યાખ્યાન સમારાદિત્ય મહાકથામાં ક્રોધ ઉપર કાબુ કેવી રીતે કરવું એ ખુબજ સરળ ભાષા માં સમજાવેલ. પૂજ્ય ગુરુદેવ ના ચાતુર્માસિક વ્યાખ્યાનો ૧૨ મહિના સુધી અરિહંત ટીવી ચેનલ ઉપર રાતના ૧૦-૦૦ થી ૧૦-૨૦ સુધી પ્રસાર થાય છે. ચાતુર્માસ દરમિયાન ગુરુદેવના દર્શનાથે કોલકાતા, ચેન્નાઈ, ટાટાનગર, કેરાલા, કોલ્હાપુર, સાંગલી, મુંબઈ, ભોજાય, નાનાભાડીયા, માપર, વાંકી, હૈદરાબાદ,બંગ્લોરે, પુના, બેલગામ તથા અન્ય વિવિધ ભાગોમાંથી સારી સંખ્યામાં પધારેલ. પૂજ્ય ગુરુદેવો નો આગામી વિહાર કોપ્પલ, હોસ્પેટ, હમ્પી, ગંગાવતી, શીંધનુર, કુસ્તાગી, ઈલકળ, બિજાપુર, સાંગલી, કોલ્હાપુર, સતારા થઈ ફેબ્રુવારીમાં પંચગીની પધારશે ત્યાં એક માસના સ્થિરતા કરશે. આગામી ૨૦૧૮ નું ચાતુર્માસ મુલુન્ડ મુંબઈ માં છે. પૂજ્ય ગુરુદેવનું મુખ્ય અભિયાન વ્યશનમુક્તિ અભિયાનમાં સ્થાનિકો જૈનો તથા જૈનેતરો ૬૦૦ થી વધુ સંખ્યામાં ભાગ લઈ વ્યશન તિલાંજલી આપેલ. એકદંરે ૨૦૧૭ નુ ગુરુદેવોનું ચાતુર્માસ ગદગવાસિઓ માટે ઐતિહાસીક અને યાદગાર સફળ રહ્યું .

મદુરાઈ

શ્રી ક.વી.ઓ.જૈન સમાજ

તા. ૨૫-૬-૧૭ ના કચ્છી નવા વરસ ની ઉજવણી ખુબજ અનોખી રીતે કરાઈ. ગ્રાઉન્ડ પર જાણે કચ્છનું નાનકડું ગામડું

ભાણું થઈ ગયું હતું . કોઈ "જંઘર" પરઅનાજ દળી રહ્યું હતું તો ક્યાંક ચુલા પર રોટલા તૈયાર થઈ રહ્યા હતા. સુપડાથી ધાન સાફ રહ્યું હતું તો કોઈ ખાટલા પર બેસી હુક્કાની ચુસ્કી લઈ રહ્યું હતું .ઢોલી ઢોલ વગાડી સાદ પાડી રહ્યો હતો તો ઘોડા પર ડાકુ હાજર હતો. નાની બાલીકાઓ માથે ઘડી લઈ આવેલ મહેમાનોનું સ્વાગત કરી રહી હતી. બાળકો પાઘડી પહેરી હાજર હતા. બહેનો હાથે મહેંદી મુકી રહી હતી. નાના બાળકોએ સરસ નૃત્ય રજૂ કર્યું અને છાયાબેને સરસ ગેમ રમાડી. કાર્યક્રમનું સંચાલન ભારતી સંગોઈએ કર્યું હતું. કચ્છી નવુંવરસ માણ્યા બાદ સૌએ કચ્છી ભોજનની લહેજત માણી.


૨. કુડતાલમ પિકનીક : તા.૨ અને ૩ સપ્ટેમ્બરના બે દિવસની પિકનીકની મજા સૌએ મજા માણી. પ્રમુખ શ્રી નીતિનભાઈ એ બધાની રહેવાની એમના " મેંગો રિસોર્ટ " પર કરી હતી. કુડતાલમ ના ડુંગરો પર વહેતા કુદરતી ઘોઘ મા ન્હાવાની મજા બે દિવસ ખુબ માણી. કુડતાલમ માં ઘણાં બધા પાણીના ઘોઘ છે જેમાં ન્હાવાનો લહાવો લેવા જેવો છે. બે દિવસ ફક્ત ન્હાવાની અને લહેજતદાર ભોજન માણવાની મજા માણી. રાત્રે કેમ્પ ફાયર મા ખુબ મજા કરી .

૩. મહિલા મંડળ: ૧. તા.૨૪-૬-૧૭ ના મંડળ તરફથી હોશિયાર જરૂરતમંદ વિદ્યાર્થીનીઓ ને શ્કોલરશીપ અપાઈ અને એજ દિવસે દિપાએ ઘરમા રહી ગયેલી સારી સારી ચીજોથી આકર્ષક પર્સ કેમ બનાવવી તે બતાવ્યું. તેમજ ભેટ વસ્તુ ને આકર્ષક રીતે કેમ પેક કરવું તે પણ બતાવ્યું.

૨. તા. ૨૨-૭-૧૭ ના " તારે તે તિર્થ " કાર્યક્રમ માણ્યો. રચના અને પ્રીતિબેને ગુજરાત ના તીર્થો ની સફર કરવી. બધા પ્રખ્યાત તીર્થોની ખુબજ સચોટ માહિતી આપી.

૩. ૨૯-૮-૧૭ ના એક અડધા દિવસના પિકનીકની મજા માણી. મદુરાઈથી ૧૦ કિ. મી. પર આવેલ એક અગરબત્તી બનાવવાની ફેક્ટરી ની મુલાકાત લીધી. લોબાન, અગરબત્તી કેમ તૈયાર થઈ એની પેકીંગ કેમ થાય છે તે જોયું.

૪. તા. ૧ અને ૨ ઓગસ્ટ ના "શોપીંગ ફ્રીવેસ્ટા" નું આયોજન મોટા પાયે કરવામાં આવેલ. છાયાબેન, રચના અને હેમલની મહેનત થી આ મહાસેલ સફળ બન્યું હતું દરેક ચીજના સ્ટોલ હતા. બહેનોએ શોપીંગ ની ખુબ મજા માણી.



શાંત પળોમાં વિચારજો

હે માનવ તું મનુષ્ય જન્મ પામ્યો આ મનુષ્ય જન્મ પામીને તે શુ મેળવ્યું, તે વિચાર નારકી કુંભીમાં ઉત્પન્ન થાય છે. દેવતાઓ સૈયામાં ઉત્પન્ન થાય છે. જ્યારે તું મા ના ઉદરમાં ઉત્પન્ન થયો અને માતા-પિતાએ જન્મ આપી તારા ઉપર અનંતો ઉપકાર કર્યો છે. એવા કેટલા અભાગી જુવો હોય છે જન્મથી પહેલા મરી જાય છે અથવા મા-બાપ ડોક્ટરો ની મદદથી કઢાવી નાખે છે. પરંતુ તું મા-બાપનો ઉપકાર માન કે તને જન્મ આપ્યો છે એટલે તને મા-બાપ મળ્યા હવે તને જન્મ આપી છોડી નથી ધીધો પરંતુ જગત જન્મથી તને સાચવ્યો છે એટલી જતનાથી કે કવિએ પોતાની કવિતામાં લખ્યું છે કે. ભીને સુઇ પોતે અને સુકી સુવાડતા આપને ક્યારે પણ તમે બોજ સમજી ને મોટો નથી કર્યો હશે જે તું બોજ સમજીને મા-બાપને સાચવી રહ્યો છે, તો ભુલ કરી રહ્યો છે. તારી તકદીરને બદલાવ, મા-બાપ એ મુડી છે એમના અંતરના આર્શીવાદ છે મે તને મળી જશે તો તેનો ભોગવટો આખો જન્મ કરીશ અને બીજાને કહીશ મા-બાપનાં આશિર્વાદ છે આ, વિવેક જો તારામાં આવી જશે તને આવા સંસ્કાર તારા સંતાનો માં પણ આવી જશે તને શીખાવવું નહી પડે એ મુડીનું વ્યાજ સમજજ અને ઔન્ય જે પ્રાપ્ત થશે એ તને બીજા જન્મમાં પણ કામ આવશે જેવી રીતે ચક્રવતિ વ્યાજ સહિત મળશે અને ભગવંતો કહે છે મા-બાપની સેવા માત્ર કરવાથી નહી પરંતુ આપણી ચામડી ઉતારવી તેના પગરખા(ચંપલ) બનાવી મા-બાપને પહેરવી સકીયે પરંતુ એમના આત્માનું કલ્યાણ થાય, એવું, ધર્મ પમાડવાથી તેમના રૂણથી મુક્તિ થાઇ સકાય માટે અંતરની આંખો ખોલી મનુષ્ય જમ મલ્યો છે એ તારા માતા-પિતાના ઉપકાર થી મળ્યુ છે. હવે સાંભળ એ માનવ જન્મ જ્યાંથી મોક્ષ જવાનો રસો મળ્યો છે. એ માનવ જન્મ દેવો ને ઇન્દ્રો(દેવોનાં દેવ) માનવ જન્મ પામી મોક્ષ માંગે કેમ આગળ વધુ એવી ઇચ્છા કરી રહ્યો છે. તો હવે શાંત પળોમાં વિચાર કે પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ એવું જીવન જેવતું છે કે મહાવીરના સંતાન કહેવાઇ એવું જીવન જીવવું છે. અગર તું મહાવીરનો સંતાન નહી બની શકે અગર સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવીકા આ ચાર તીર્થ છે એમાં સ્થાન નહી પામી શકે તો ચોચાસીના ચક્કરમાં અટવાઇ જઇશ ને પછી માનવ જન્મ મેળવવા અનંતો સમય વીતી જરો માટે જાગ માનવ જાગ સમયને સમજ.

જીવનચક્ર

દેવના દીધેલ

હૈદરાબાદ ઘટક: પુત્ર જન્મ

- ૧) દેવાંશ સ્નેહલ હિમાંશુ કિશોર ગોસર હાલાપર
૨) શ્રીમતી હિરલ શ્રીપાલ રતનશી દેઢિયા નાગલપર

બેંગલોર ઘટક: પુત્ર જન્મ

- ૧) રીઆન ગીતાંજલિ પુનીત સાવલા વાંકી

ચેન્નઈ ઘટક: પુત્ર જન્મ

- શ્રીમતી ભવિકા મિલન રમણિક ગોગરી

ઉત્તર કર્નાટક ઘટક : ગદગ : પુત્ર જન્મ

- ચી.દેવ સોનિયા સુહાસ રમણીકલાલ નાગડા મોટીઉણ્ણોઠ

ગોળધાણા

ચેન્નઈ ઘટક

૧. ચી. કલશ જયેશ યુનીલાલ દેઢિયા બોરારા ચેન્નઈ
ચી. પ્રાચી સજય જૈન (બોકાડીયા) લાડનૂ ચેન્નઈ
૨. ચી. શ્રેય શૈલેષ પ્રાગજી દેઢિયા બિદડા ચેન્નઈ
ચી. આકાશ ધર્મેહ ભવાનજી રાંભિયા નાના ભાડિયા મુંબઈ

કુમકુમ પગલા

બેંગલોર ઘટક

૧. કુ. રક્ષા હરિલાલ સાવલા વાંકી બેંગલોર
ચી. સુનીત શ્યામસુંદર મહેતા દિલ્હી

ઉત્તર કર્નાટક ઘટક : હુબલી

૧. ચિ. નિશા પ્રકુલ મામણિયા કપાયા હુબલી
ચિ. મિતેશ લક્ષ્મિચંદ ગંગર ગોધરા મુંબઈ

ઉત્તર કર્નાટક ઘટક : ગદગ

૧. ચી.દિશાન્ત દિલીપ ગાલા ભોજાય ગદગ.
અ. સો. માનસી ચેતન ગોસર માપર સોલાપુર

પરલોક ગમન

બેંગલોર ઘટક

- ૧) શ્રી મગનલાલ કાનજી ધરોડ પત્રી ઉ.વ. ૮૯
22

BIJAPUR VIJAYA BHAVAN OPENING CEREMONY



BIJAPUR VIJAYA BHAVAN OPENING CEREMONY



૨) શ્રી વિસનજી ભાણજી કારાણી ડુમરા ઉ.વ. ૮૪

ચેન્નઈ ઘટક

૧.શ્રી મોરારજી ખીમજી કેનિયા	બારોઇ	ઉ. વર્ષ ૬૮ તા.૨૦-૦૭-૨૦૧૭
૨.શ્રી મણિલાલ પ્રેમજી ભેદા	ભુજપુર	ઉ. વર્ષ ૮૬ તા.૧૮-૦૯-૨૦૧૭
૩.શ્રી કાંતિલાલ મોરારજી મારુ	ચિયાસર	ઉ. વર્ષ ૬૮ તા.૦૬-૧૦-૨૦૧૭

હૈદરાબાદ ઘટક

૧) શ્રી ભરતભાઈ મગનલાલ ધરોડ	પત્રી	ઉ.વ ૫૭
૨) શ્રીમતી રૂક્મણીબેન હીરજી નિસર	વડાલા	ઉ.વ.૮૦
૩) શ્રીમતી જવેરબેન પ્રેમજી ગાલા	લાખાપર	ઉ.વ.૮૫
૪) શ્રીમતી લક્ષ્મીબેન યુનીલાલ ગાલા	લાખાપર	ઉ.વ.૮૪
૫) શ્રી ખીમજી ડુંગરશી મામણીયા	મેરાઉ	ઉ.વ ૮૮
૬) શ્રી દિપક શિવજી ધરોડ	પત્રી	ઉ.વ ૬૬
૭) શ્રી સુમિત કલ્યાણજી ગંગર	મેરાઉ	ઉ.વ ૩૩



ચવનપ્રાશ

સામગ્રી : ૧ કિલો આવલા, ૧/૨ કિલો સાકર, ૨ મોટા ચમચા ઘી

મસાલા:૬ ગ્રામ કૈશર, ૨૫૦ ગ્રામ બદામ, ૨૫૦ ગ્રામ અખ્રોટ, ૧૦૦ ગ્રામ સુંટ, ૨૫ ગ્રામ ગંઢોડા, ૧૦૦ ગ્રામ એલાચી, ૫ ગ્રામ તજ, ૧૦ ગ્રામ લવિંગ, ૧૦ ગ્રામ મરી, બધા મસાલા ખાંડી લો

રીત:સૌ પ્રથમ આમળાને ઘોઇ ને સાફ કરો આમળાને ચાબકીમાં વારળે બાફી લેવા- પછી એમાથી બિયા કાઢી સાકર સાથે મિક્સર માં પિસી લેવું. એક કટોરીમાં ઘી નાખી આ મિશ્ર ને એક સરખુ- મધ્યમ તપિ ઘટ્ટ્યામ વ્યા સુધી સતત હલાવતા રહેવું. ઘટ્ટ થાય વ્યારે ઉપરના બધા મસાલા થાળમાં બરાબર મિક્સ કરી થંડૂ તાય પછી એર ટાઇટ બરણીમા બરી લેવો. ચવનપ્રાશમા વિટામીન C ભરપુર માત્રામા હોયે. ઠંડીમાં દરોજ સવારમાં નીરાણે ૧ ચમચ લેવો.

લી. શ્રીમતી જયશ્રી સચીન ગોગરી, હુબલી, ૯૪૪૭૬૮૪૯૦




અડધીયા

સામગ્રી:૧કિલો અડદની ધાન, ૧કિલો માવો, ૧.૫કિલો ઘી, અંદજે ૧.૫ કિલો જેટલી સાકર, ૨૫૦ ગ્રામ ગુંદર

મસાલા:૫૦ ગ્રામ જાવંત્રી, ૧૦૦ ગ્રામ સુંઠ (વાધારે પણ નાખી શકાય), ૧૦ ગ્રામ પંજીની મુસળી, ૧૦ ગ્રામ કાળી મુસળી, ૧૦ ગ્રામ સફેદ મુસળી, ૧૦ ગ્રામ પંજીની સાલમ, ૧૦ ગ્રામ સાલમ મુસરી, ૨૫ ગ્રામ

પીપરમુળના ગંઠોડા, ૨૫ ગ્રામ ગોખરુ, ૧૦ ગ્રામ લાજપતી, ૧૦ ગ્રામ નાગકૈશર, ૧૦ ગ્રામ અશ્વગંધા, થોડુક તજ, લવીંગ, ખસખસ, અચેરીયો, પીસ્તા, બદામ, એલાચી. બધો મસાલો તડકે સુકાવી, સાફ કરી, ખાંડી નાખો, પાવડર કરી લો, મસાલા એમાથી તમારી ઇચ્છાનુસાર તમે નાખી સકો.

રીત:પહેલા અડદના લોટને ઘીને દુધનો ચાબો આપવો, પછી ચાળીને શેકવા માટે કડાઇ માં લેવો , ઘી નાખીને શેકવો થોડુક શેકાઇ જાય પછી માવો નાખવો, માવો નાખીને પછી થોડુક શેકો, બદામ કલરનુ થાય ત્યા સુધી શેકવાનુ, ગુંદર ને ઘી મા અલગ થી તકી લો. પછી એમા ગુંદર નાખી એક બાજુ સાકરની ચાસણી કરવા મુકવી, સાકરની ચાસણી માટે તમે



અંદાજે મસાલા જેટલા નાખો એનું વાફી થી માપ લઈ લેવું, અડદનો લોટ, માવો અને મસલો ને ગુંદર જેટલા વાટકા થાય એટલી પોણા ભાગની સાકર નાખવી સાકર ઓછી જોઈએ તો અર્ધી પણ નાખી શકો, ચાસણી ૨ તારની કરવી, ચાસણી થઈ ગયા પછી ગરમ-ગરમ લોટમાં નાખી થાળીમાં પાથરી દેવું, ઉપરથી પીસ્તા-બદામની કતરણ નાખી દો.

લી. શ્રીમતી સ્મિતા નરેન ગોસર, હૈદરાબાદ



વિવિધ વાનગીઓ

૧. નાળિયેરનું દૂધ કાઢવાની રીત: તાજા ખમણેલાં એક નાળિયેરમાં ત્રણ કપ પાણી નાંખી, લિક્વીડાઈઝરમાં પાંચ મિનિટ ચર્ન કરવું પછી બારીક કપડાંથી ગાળી લેવું. લિક્વીડાઈઝર ન હોય તો નાળિયેરના ખમણમાં ત્રણ કપ પાણી નાંખી એક કલાક રહેવા દેવું. પછી બારીક કપડાંથી ગાળી, દૂધ તૈયાર કરવું.

૨. ટમેટા બાફવાની રીત : ઉકળતા ગરમ પાણીમાં ટમેટા પાંચ મિનિટ રાખવા. પછી ટમેટા ઠંડા પડે એટલે છાલ કાઢી, તેનો માવો ઉપયોગમાં લેવો. આમ કરવાથી છાલ ક્યાંય દેખાશે નહિ.

૩. વ્હાઈટ સોસ બનાવવાની રીત: ૩ કપ દુધ ૩ ચમચા કાપીને કોર્નફ્લોર ૧ ચમચો માખણ પ્રમાણસર મીઠું અને મરી ૨ કપ દૂધ ગરમ મૂકવું. તેમાં માખણ નાંખવું. બાકીના ઠંડા દૂધમાં કોર્નફ્લોર નાંખી હલાવવું. ગરમ કરવા મૂકેલા દૂધમં ઉભરો આવે પછી કોર્નફ્લોરવાળું દૂધ નાંખી હલાવવું. બે ઉભરા લાવી નીચે ઉતારી મીઠું અને મરીનો ભૂકો પ્રમાણસર નાંખવાં. વ્હાઈટ સોસ એલ્યુમિનિયમનાં વાસણમાં બનાવવો. સોસ જાડો બનાવવો હોય તો ૩ ચમચા ભરીને કોર્નફ્લોર લેવો.

૪. ચીઝ સોસ બનાવવાની રીત : ત્રણ કપ વ્હાઈટ સોસ માં ૩/૪ કપ ચીઝ ખમણીને નાંખવું. ગરમ કરી નીચે ઉતારવું. એટલે ચીઝ સોસ તૈયાર.

૫. ટમેટો સોસ બનાવવાની રીત : ૫૦૦ ગ્રામ ટમેટાં, ૧ ચમચો માખણ, ૨ લવિંગ, ૪ ચમચા ભરીને સાકર, ૧૦૦ ગ્રામ ગાજર, ૧ ચમચો મેંદો, ૧/૪ કપ વિનેગર, ૨ મધમ કાંદા, ૨ તમાલપત્ર, મીઠું અને લાલ મરચું પ્રમાણસર

કાંદા અને ગાજરના ટુકડા માખણમાં સાંતળવા. મેંદો નાંખી હલાવવું. ટમેટાના ટુકડા નાંખવાં. ત્રણ કપ પાણી નાંખવું. તમાલ પત્ર, લવિંગ, મીઠું અને સાકર નાંખી ૩૦ મિનિટ ઉકાળવું. ઠંડું પડે પછી સુપના સંચાની વચલી જાળીથી ગાળી લેવું. લાલ મરચું અને વિનેગર નાંખી, હલાવી બોટલ ભરવી. તાજો સોસ વાપરવો હોય તો વિનેગર નાંખવું નહિ.

૬. સૂપ માટે સ્ટોક બનાવવાની રીત: ૨ બટેટા ૫૦ ગ્રામ ફણસી ૧ ચમચી કાપીને મીઠું ૧ ગાજર, ૧ કાંદો, ૭ કપ પાણી સ્ટોક : દરેક સુપ માટે સ્ટોકની જરૂર પડે છે. આ સ્ટોક પ્રેશર કુકરમાં ૩૦ મિનિટમાં કરી શકાય છે. બધા શાક સમારી પાણી અને મીઠું નાંખી પ્રેશર કુકરમાં બાફવા મુકવાં. સીટી વાગે પછી ૧૦ મિનિટ ધીમા ગેસ પર રાખી ગેસ બંદ કરવો. ફૂકર ઠંડું પડે પછી બધાં સાગવપાણી સહિત સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવાં. આ સ્ટોક (ગાળેલું શાકનું પાણી) લગભગ બધા સુપમાં વાપરી શકાય. બજારમાં સ્ટોકની ક્યૂબ મળે છે, તે ચિકન અગર માંસની બનાવટ છે.

૭. ઈંડા વગરનું મેયોનીઝ બનાવવાની રીત(૧ કપ) : ૧ ૧/૨ કપ દૂધ, ૧ ચમચો માખણ, ૧ ચમચી સાકર, ૧ ચમચો વિનેગર, ૧ ચમચો ભરીને કોર્નફ્લોર, ૨ ચમચા તેલ (રિફાઈન), ૧ ચમચી રાઈનો પાવડર પ્રમાણસર મીઠું અને મરી ૧ કપ દૂધ ગરમ કરવું. તેમાં માખણ નાંખવું. ૧/૨ કપ ઠંડા દૂધમાં કોર્નફ્લોર હલાવવો. ગરમ દૂધમાં ઉભરો આવે પછી ઠંડું કોર્નફ્લોરવાળું દૂધ નાંખવું. બે ઉભરા આવે પછી નીચે ઉતારી તરત જ તેલ ધીમે ધીમે નાંખી હલાવવું. મીઠું અને મરી નાંખવાં. એક વાસણમાં રાઈનો પાવડર અને સાકર મૂકી ફીણવું. તેમાં વિનેગર નાંખી પાછું ધૂંટવું. તૈયાર કરેલો રાઈનો પાવડર દૂધમાં નાંખી હલાવવું. તૈયાર કરેલા દૂધને મેયોનીઝ કહેવાય. મેયોનીઝ ફ્રીજમાં રાખવું. વિનેગર બદલે અર્ધા લીંબુનો રસ નાંખી શકાય. રાઈનો પાવડર બજારમાં મળે છે. બની શકે તો ખલદસ્તામાં રાઈનો પાવડર અને સાકર મૂકી ધૂંટવું. મેયોનીઝ બનાવવા માટે એલ્યુમિનિયમનું વાસણ લેવું.

ફરસાણ સાથે જમણમાં આપી શકાય તેવાં ચટણી અને રાચતાં

૧. ફુદીનાની ચટણી : ૧ જુડી ફુદીનો, ૧ જુડી કોથમીર, ૨ લીલા મરચાં, ૨ ચમચા ગોળ સમારેલો, પ્રમાણસર મીઠું, ૧ નાનો કાંદો, ૧ નાનો ટુકડો આદુ, ૧ ચમચો ભીંજવેલી આંબલી, ૧ ચમચી જીરું— બધી વસ્તુઓ ભેગી કરી, બારીક ચટણી વટવી, સમોસા અને પકોડા સાથે આપવી.

૩. કાંદાની ચટણી : ૩ મધ્યમ કાંદા, ૨ લીલા મરચાં, ૧ ટુકડો આદુ, ૧ ચમચો ઘી, ૧ ટમેટું, ૧/૨ કપ ખમણેલું નાળિયેર, પ્રમાણસર મીઠું, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી અડદની દાળ, ૧/૨ કપ કુદીનો, ૧ કપ કોથમીર, ૧ ચમચી લાલ મરચું— કાંદાને બારીક સમારવા, તેમાં ઘી, રાઈ અને અડદની દાળ સિવાય ઉપરનો બધો મસાલો નાંખી ચટણી વટાવવી. ઘી ગરમ મૂકવું. તેમાં રાઈ અને અડદની દાળ નાંખી વઘાર કરવો.

૪. આંબલીની ચટણી : ૧ કપ આંબલી, ૩/૪ કપ ગોળ, ૩/૪ ચમચી શાકનો ગરમ મસાલો, ૧ ચમચી લાલ મરચું, પ્રમાણસર મીઠું— આંબલીને ૨ કલાક પલાળી તેનો રસો ગાળીને લેવો, તેમાં ગોળ, મરચું, મીઠું અને ગરમ મસાલો નાંખી બરાબર હલાવવું.



રાયતા

૧. કાકડીનું રાયતું : ૧/૪ કિલો કાકડી, ૧/૪ કપ કોથમીર, પ્રમાણસર મીઠું, ૧/૨ ચમચી વાટેલાં આદુ મરચાં, ૧/૨ ચમચી સાકર, ૧/૨ ચમચી ફીણેલી રાઈ, ૩/૪ કપ પાણી નિતારેલું દહીં— રાઈને વાટી, તેમાં ૧ ચમચી પાણી નાંખી ફીણવું. કાકડીની છાલ, આદુ, મરચાં, કોથમીર, સાકર અને ૧/૨ ચમચી ફીણેલી રાઈ નાંખવાં. ઠંડુ કરવું.

૨. કોપરાનું રાયતું : ૧ ૧/૨ કપ પાણી નિતારેલું દહીં, ૧/૨ કપ ખમણેલું કોપરું, ૧ ટુકડો આદુ, પ્રમાણસર મીઠું, ૪ લીલા મરચાં, ૨ નાના લાલ કાંદા— કોપરું, લીલા મરચાં, આદુ અને કાંદા સમારીને સાથે વાટવાં. દહીંમાં સંચો ફેરવી મીઠું નાંખવું. તેમાં વાટેલી કોપરાની ચટણી નાંખવી.

૩. ફણગાવેલા મગનું રાયતું : ૧ ૧/૨ કપ પાણી નિતારેલું દહીં, ૧ ચમચી વાટેલાં આદુ-મરચાંની ચટણી, ૧/૨ કપ બાફેલાં બારીક કરેલા બટાટા, ૧ ચમચી શેકેલા જીરાનો ભૂકો, ૧ કપ બાફેલાં, ફણગાવેલા મગ— દહીંમાં સંચો ફેરવી મીઠું નાંખવું. તેમાં મગ, આદુ-મરચાં અને બટાટા નાંખવાં. ઉપર શેકેલા જીરાનો ભૂકો નાંખવો. ૧/૨ કપ બારીક કરેલા લીલા કાંદા નાંખી શકાય.

૪ .ટમેટાનું રાયતું : ૧ ૧/૨ કપ પાણી નિતારેલું દહીં, ૧/૨ કપ બારીક કરેલા લીલા કાંદા, ૧/૨ કપ કોથમીર, ૧/૨ ચમચી લાલ મરચું, ૧૦૦ ગ્રામ બારીક કરેલા ટમેટાં, ૨ લીલા મરચાંના બારીક ટુકડા, પ્રમાણસર મીઠું— દહીંમાં સંચો ફેરવી મીઠું નાંખવું. તેમાં ટમેટાં, કાંદા, મરચાં અને કોથમીર નાંખી હલાવવું. ઉપર લાલ મરચાંની ભૂકી ભભરાવવી.

ગીતા વિરેન્દ્ર છેડા, હુબલી, 9448366364



‘પાકેલુ પાંદડું’



વાવડમાં વડીલોમાટે ‘પાકેલુ પાંદડું’ આ વિભાગમાં તમે તમારા જીવનની પ્રેરણાદાયી

ઘટનાઓ—પ્રેરક પ્રસંગમાં, કચ્છની વાતો કચ્છડેજી કચું ઘાલ્યુંમાં અને ગમતાના ગુલાલમાં તમે તમારા અનમોલ અનુભવ અને વિચાર અને તમે અનુભવેલ રોમાંચિત સફરના આનંદ વ્યક્ત કરતી તમારી વાર્તાઓને આગામી અંક માટે નીચે આપેલ સરનામા પર મોકલાવી શકો.

ઈ-મેલ: vavad.bellary2015@gmail.com અને સરનામું છે:

“Vavad”, Mr. Narendra Savla, “Bharat Automobiles”, shops no. 50 & 5, Sri M V Lorry terminal, Bellary-583101. લખાણ સાથે તમે તમારું પુરૂ નામ, ગામ, કોન્ટેક્ટ નંબર, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ઈ-મેલ એડ્રેસ આપવાનું છે.

સૌ.મીના ચંદ્રકાંત દેઢીયા,(દેશલપુર,કંઠી) બેલ્લારી,9449011153

With Best Compliments From

M/s. Sweet N Salt

Manufacturer , Wholesaler N Retailer in Sweets N Namkeen Since Last 40 Years

M/s. Uttam Dresses

Retailer of Kids Readymade Garments

Gala Online Service

Online Ticket Booking Of Train , Flight , Bus , Hotel N Tour Booking Across The World

Gala Caterers

New Venture By Our Group , With The Aim To Serve Tasty N Quality Food
With Best Service

Shri. Virji Palan Gala School Of Nursing

3 ½ Year Diploma In General Nursing & Midwifery Course

Shri. V. P. Gala Institute Of Para Medical Science

Diploma In Medical Lab Technician , Diploma In Health Inspector Courses

Gala Parivar , Gadag

Pankaj Virji Gala
9448137039

Bharat Virji Gala
8123657572

Gunjan Pankaj Gala
9448165721

Dishant Dilip Gala
9986513052

BIO DATA



NAME : GUNJAN ARVIND MAMNIYA

DATE OF BIRTH : 03-10-1990

TIME OF BIRTH : 11:50 A.M. @ HUBLI

HEIGHT : 6'2"

WEIGHT : 90KG

COMPLEXION : WHEATISH

VILLAGE : KAPAYA

CURRENT RESIDENCE: HUBLI/BANGALORE

QUALIFICATION : MBA(SUPPLY CHAIN MANAGEMENT)

CURRENT WORK : OCWEN FINANCIAL SERVICES LTD, BANGALORE

DESIGNATION : PROCUREMENT SPECIALIST IN MNC

HOBBIES : LISTENING SONGS, READING, TRAVELING,
WATCHING MOVIES, PLAYING INDOOR GAMES ETC

ADDRESS : SHRINIVAS APARTMENT, H. NO. 18, HOSUR ,
2ND CROSS, HUBLI-580021

GRAND MOTHER : DEVKABAI MORARJI VERSHI MAMNIYA

FATHER NAME : ARVIND MORARJI VERSHI MAMNIYA- 9448113701

MOTHER NAME : KUSUM ARVIND MAMNIYA

MATERNAL : KASTURBAI DAMJI NARSHI CHHADVA, KARAGOGA

ADDRESS : H. NO. 4, PHDKEWADA, KOREGAON- 415501

CONTACT NUMBERS : 02163221721, (M) 9420633300

ELDER SISTER : CHAITALI KAPIL GALA, LAKHAPUR, MATUNGA(9892085534)

Photos from Madurai



ગામતા ના ગુલાલ

સત્ય ઘટના— સાચને આંચ ન આવે

લગભગ ૧૫૦ વર્ષ પહેલાં બનેલી સત્ય ઘટના છે. કચ્છમાં વાંકી નામનું ગામ છે. તે ગામમાં પાલણશા નામના ગૃહસ્થ રહે અને ઉમરબાઈ નામની પતિવ્રતા અને નીતિવાળી સ્ત્રી હતી. એમને એક પુત્રી હતી તેનું નામ નેરણ હતું. એક વખત નેરણ કપડાં ધોવા નદીએ ગઈ. ત્યાં શરીરની હાજતે એકાંતમાં જતાં જમીનમાં કંઈક કઠણ વસ્તુ લાગી, એટલે તણી એ ત્યાં ખાડો કર્યો.ત્યાં તેને બે મુઠ્ઠી કાટખાઈ ગયેલી કોરીઓ(કચ્છનો ચલણી સિક્કો) દેખાણી. નેરણે તે લઈ લીધી. ઘરે આવી માતા ને આપી.માતા હતી નીતિવાળી તેથી પુત્રીને કહ્યું “આપણને પારકી થાપણ જોઈએ.” એટલામાં પાલણશા પણ ઘરેઆવ્યા. ઉમરબાઈએ તેમને કોરીઓ મળવાની વાત કરી. બન્નેએ નક્કી કર્યું કે પારકી થાપણ આપણને ન જોઈએ,તેથી પાલણશા બધી કોરીઓ લઈને થાણે ગયા.ત્યાં રહેલા પોલીસને બોલાવી, પોતાની ટિકરીને કોરીઓ ક્યાંથી,કેવી રીતે મળી તે વાત જણાવી.પોલીસે કોરીઓ ઠાકોરને આપી. ઠાકોર પાલણશાની નીતિમત્તા ઉપર ખુબ ખુશ થઈ ગયા, ખુબ ખુબ પ્રશંસા કરી.ખરેખર આવા નીતિમાન લોકો બહુ થોડા હોય છે. આવાતની ખબર ઠાકોર સાહેબના દિવાનને પડી. એને થયું કે પાલણશા ને રાજા મહત્તા આપશે તો રાજદરબારમાં એનું સ્થાન ઊંચું આવશે, એનું સન્માન વધી જશે. તેથી તેનામાં ઈર્ષા જાગી. આનું નામ તેજો દ્વેષ.

એક દિવસ ઠાકોરને તે ભ્રમણ માં નાખતાં કહ્યું કે, “સાહેબ, આપ અમારી વણિકોની કળા ન જાણો, પાલણશા એ કોરીઓનો મોટો જથ્થો પોતાની પાસે રાખી લીધો છે.અને થોડીક કોરીઓ બતાવીને આપની ઉપર છાપ પાડવાનો પ્રયત્ન કર્યો છે. આપ એનાથી ભોળવાઈ જતા નહિ.” આ વાત ઠાકોર સાહેબનામગજમાં બરાબર ઠસી ગઈ. એટલે દિવાનને કહ્યું કે “તમારી વાત જાણી સાચી લાગે છે. હવે શું કરીશું?” દિવાને તરતજ કહ્યું, “ચાલો આપણે એના ગામ જઈએ ને યોગ્ય કાર્ય કરીએ.” ઠાકોરે તો આ દિવાનની વાત સત્ય સ્વરૂપે માની લીધી; એટલે જ કહેવત પડી છે કે “રાજા,વાજા ને વાંદરા, તેમને વાન હોય છે, પણ શાન હોતી નથી” ઠાકોર અને દિવાન પોતાના રસાલા સાથે વાંકી આવ્યા.થાણામાં બેઠક જમાવી, પાલણશા ને બોલાવ્યા.તેઓ ખેતરે ગયા હતા, તેથી તેમની પત્નીને બોલાવી ને ધમકી આપીને કહ્યું, “કોરીઓનો મોટો ભંડાર તમારી છોકરી ને મળ્યો છે,તેમાંથી થોડી કાઢી અમને આપી છે, બાકીની સંતાડી દીધીછે; તો તે અમને આપી દો, પાલણશા અમને કહેતો ગયો છે કે તમે મારા ઘરે કહેશો તો તે કોરીઓ નો બધો જથ્થો આપી દેશે.” દિવાને બનાવીને વાત કરી. ઉમરબાઈએ જવાબ આપતા કહ્યું, “ઠાકોર સાહેબ, અમને જેટલી મળી તે બધી આપી દીધી છે. અમારા આખા ઘરનો એવો નિયમ છે કે ‘પારકી થાપણ (વસ્તુ) લેવી નહી. એટલે અમને જે મળ્યું તે બધું આપને સોંપી દીધું છે. એ સિવાય બીજું કંઈ અમને મળ્યું જ નથી, અમે અસત્ય કદી બોલતા નથી.”

તે છતાંય ઠાકોર અને દિવાન માન્ય નહિ, ઉલટું દિવાન ના કહેવાથી રાજાએ માણસોને હુકમ કર્યો કે ‘રાંપ ધખાવીને એને હાથમાં આપો એટલે તરતજ સાચા જુઠાનો ન્યાય થઈ જશે.’ ઉમરબાઈ એ પ્રત્યુત્તર વાલ્યો, “હજૂર,અત્યારે સતયુગ નથી, આતોહળાહળ કલિયુગ છે.માટે એવી પરીક્ષા રહેવા દો. અમેજેકહીએ છીએ તેસત્ય જ છે. પછી તો જેવી તમારી મરજી.”ઠાકોર અને દિવાન માન્યા નહિ. સત્તાનો નશો બહુ ખરાબ હોય છે. પાલણશાને ખબર પડી એટલે તે દોડતા આવ્યા તેણે ઘણું કહ્યું “સાહેબ, અમ જેવા સત્યવાદીઓના પારખાં રહેવા દો.”પણ તે ન માન્યા અને ઉમરબાઈ પરીક્ષા માટે તૈયાર થયા.ખરેખર કસોટી તો કંચન ની થાય છે. તેમણે બન્ને હાથમાંની હથેળીમાં એક એક પીપળાનું પાન મૂક્યું અને કહ્યું,“ચાંપો રાંપ.”રાંપ ચાંપી.છતાં તેના સત્ય અને શીલના પ્રભાવે ઉમરબાઈ ને ઉની આંચ ન આવી.દિવાન ભોંકો પડ્યો,છતાં તેણે પોતાનું જુઠાણું મૂક્યું નહિ,તેણે કહ્યું ‘હજૂર, તેમણે પીપળાના પાન હથેળીમાં રાખ્યા હતાં તે થી કેમ દાઝે? તેમની હથેળી માંથી પાન લેવડાવી લો અને પછી રાંપ ચંપાવો.’ ફરીથી રાંપને ગરમ કરી. ફરીથી ઉમરબાઈના ખુલ્લા હાથ ઉપર રાંપ ચાંપી પણ તેના સત્યના પ્રભાવ થી જરાપણ આંચ ન આવી. આથી ઠાકોર તથા આખી પ્રજા ઉમરબાઈનો મહિમા ગાવા લાગ્યા પણ દિવાનના અંતરમાં તો ઝેર ભરેલું હતું તે બોલ્યો, “ હજૂર! એ રાંપ ઠરી ગઈ લાગે છે,એટલે એ ક્યાંથી દાઝે?” દંભી માણસો પોતાના દંભને છોડતા નથી.

પાલણશા એકદમ ઉકળી પડ્યા અને કચ્છી ભાષામાં ઉમરબાઈને કહ્યું, “રાંપ ઠરે વઈવે ત વારે ને ઠાકોરજી નળીમેં વજ.” એટલે રાંપ કરી ગઈ હોયતો તેને વાળી, નાખી દે ઠાકોરના ગળામાં, લોકો સ્તબ્ધ થઈ ગયા. ઉમરબાઈ તરતજ સમજી ગઈ રાંપ લઈને ઠાકોર અને દિવાન તરફ દોડી જ્યાં ઠાકોર ને ચાંપવા જાય છે, ત્યાં ઠાકોર અને દિવાન બન્ને ઉભી પૂંછડીએ ભાગ્યા. ઉમરબાઈ પણ તેમની પાછળ દોડી. ભાગતાં ભાગતાં ઠાકોર અને દિવાન ને શાપ આપ્યો કે, “તમારા બન્નેનું સત્યાનાશ વળી જશે.” એમ કહી સતી પાછી ફરી. લોકો એ જય જયકાર બોલાવ્યો. સત્યનો વિજય થયો. વર્ષો પછી ઠાકોર સાહેબ અને દિવાનના વંશજોનો સર્વથા નાશ થઈ ગયો. ઉમરબાઈ સતી સ્ત્રી હતી અને સત્યવાદી પણ હતી. પરિણામે તે કલિયુગમાં પણ અગ્નિપરીક્ષામાંથી હેમખેમ પાર ઉતરી ગઈ. તેની આંતરડી દુભાવી જેના પરિણામે ઠાકોર અને દિવાનના કુટુંબનો નાશ થઈ ગયો.

સારાંશ:આ પ્રસિદ્ધ દુહામાં સાચુંજ કહ્યું છે કે, “સંત સતી સંતાપતા, ટળે ધર્મને વંશ, ન માનો તો જોઈ જુઓ, યાદવ, રાવણ, કંસ.”

પ્રેમીલા કીશોર છેડા, બાગલકોટ, ૦૭૨૫૯૭૦૪૭૧૪

Editor's message

From me to you

Dear readers,



Festivals bring celebrations and fun but I think our school life also engenders life time School days with friends are memorable for all of us. I remember one incidence narrated by school friend. A plumpy, chubby middle school boy. One day came back from school within half an hour and told his mother that he would never go to school again. Surprised with his reply, mother asked him, why?

“As soon as I enter the classroom, all the boys laugh mockingly looking at my personality (meaning fatty); I am ashamed of the same and hence I will not go to school henceforth.” Was his reply. Mother with her wisdom understood the predicament of the boy and took him back to the school, waited for the start of the next period and asked the boy to enter the classroom. The boy hesitantly entered the classroom and as usual, the whole classroom immersed in laughter. Slowly mother followed the boy, allowed the laughter to subside. with all the love and concern looked at the boys in the classroom and called one of the boys in the first bench and told him: ‘look my dear, I will give next 5minutes time, can you make your friends here to laugh heartily once more.’ The boy did not succeed in spite of his efforts.it was the same with two more boys. Then she told her son in front of the whole class room, “look my dear son, god has specially created you bestowing with the gift of making people laugh; so do not worry about your size.” And she left the classroom. From that day onwards, that fatty boy became much friendlier to everybody and for the rest of his life, his size did not bother him.

Friends, school not only provides us education from books but also helps to build our personality. The place where we spend our best childhood days, our growth years and our moments of happiness, sorrows and all other emotions. Friends, you can share your school time memories with Vavad. Let us relish those sweet memories.....

Mrs Nilam Hitesh Chheda, Baroi, Ballari (9449226670)



આગામી કાર્યક્રમ

બધાને સહર્ષ જણાવીએ કે મહાસમ્મેલનનું આયોજન 26 શનિવાર અને 27 રવીવાર, જાન્યુઅરી 2019 વિજયા કચ્છીભવન, બીજાપુરમાં યોજવામા આવશે. બધાએ સહપરિવાર ભાગ લેવા વિનંતી. કાર્યક્રમની રૂપરેખા વાવડના આગામી અંકમાં જણાવવામાં આવશે.

શ્રી વિરેંદ્ર દામજી છેડા

શ્રી પંકજ વિરજી ગાલા

શ્રી નરેંદ્ર નાનજી સાવલા

હુબલી, પ્રમુખ, દ.ભા.ક.વી.ઓ.

ગદગ, મંત્રી, દ.ભા.ક.વી.ઓ.

બેલ્લારી, પ્રમુખ, યુ. કે. જી.

EKKAM's GOT TALENT

હૈદરાબાદ ઘટક

(૧) કુમારી હેતવી રવિન્દ્ર ગોસર	હાલાપુર	10 th class ૯.૪ cgpa
(૨) કુમારી ભાર્ગવી જયેશ વીરા	લાખાપુર	12 CBSE 92.4 %
(૩) કુમારી નિકિતા અરવિંદ પાસડ	નવીનાર	B.Fine Art 76.56 %
(૪) કુમારી જીનલ મહેશ ધરોડ	પત્રી	Masters in finance 7.1 %
(૫) જેનીશ મુકેશ ગાલા	છસરા	B.Com 89.2 %
(૬) ધિરેન વિલાસ ગાલા	સાભરાઈ	C.A. 54 %
(૭) કુમારી આશ્રુતિ વિપુલ નિસર	વડાલા	M.A. IN Fashion – Merit

Gold Medalists for the academic year 2016-2017

1. 10th class : Khush Meenal Ramesh Savla Mothara 10 CGPA



2. 12th class - Science Jeet Dipti Nayan Savla Moti Rayan 96.9 in BiPC



3. 12th Class –Commerce Sakshi Swetha Sagar Gala Devpur 39/42 IB



4. BBA Pankti Rekha Piyush Gada Lathedi 9.83 CGPA



5. Bachelor of Design Devika Kalpana Sushil Kapadia Patri 7.5 CGPA



6. Chartered Accountancy Neeti Kajal Vipul Shah Vadala 53.87%



7. Bachelor of Dental Science Dr. Twinkle Lata Ajeet Gala Desalpur 66.83%



મદુરાઈ કચ્છી સમાજના પ્રમુખ શ્રી નિતીનભાઈ દેહીયા જેઓ મદુરાઈ JSG ના પ્રમુખ છે તેઓ JSG South Region ના vice chairman તરિકે ચુંટાયા છે.

We, team of Vavad, congratulate all the achievers for their achievements.

S.No Name Parents Name Surname Village Board %

TENTH CLASS:

1. Femi Manisha Dipesh Gada	MotaAsambia	CBSE	9.8 CGPA
2. Manan Avani Anish Chheda	Godhara	CBSE	9.6 CGPA
3. Jemin Priti Jayesh Vira	Lakhapar	CBSE	9.0 CGPA
4. Vanshika Dipti Nayan Savla	MotiRayan	ISCE	88.4 %
5. Yashita Bindu Jayesh Dedhia	Bhujpur	CBSE	8.8 CGPA
6. Bhavik Vaishali Kamlesh Rambhia	MotaAsambia	ISCE	88.0 %
7. Neel Bela Nimesh Bheda	Bhujpur	SSC	8.7 CGPA
8. Meet Heena Vipul Gala	Nana Asambhia	SSC	8.7 CGPA
9. Simran Leena Vipul Savla	Laija	SSC	8.3 CGPA

12th SCIENCE

1. Amita Kusum Vallabhji Rambhia	Gundala	BiPC	96.8 %
2. Mayank Rakhee Roshan Maru	Halapur	MPC	91.3 %
3. Yash Bindu Jayesh Dedhia	Bhujpur	MPC	90.2 %

12th COMMERCE

1. Aarti Neeta Nitin Satra	Gundala	MEC	90.70%
2. Karan Reeta Jitender Gala	Lakhapar	MEC	88.10%
3. Dhruv Harita Vijay Maroo	Halapur	CBSE	85.20%

GRADUATION

1. Harsh Trupti Naresh Shah	Samakhiyari	BBA	83.93%
2. Uday Vijaya Devchand Karani	Bada	B.Com	77.40%
3. Komal Geeta Kishore Gala	Pratapur	B.Com	75.43%

PROFESSIONAL COURSES:

COMMERCE

1. Vihit Heena Vipul Maru	Godhra	CA	51.63%
2. Aakash Pallavi Vilesh Gala	Moti Khakhar	CFA	

ARTS

1. Apeksha Rajul Dirgesh Nishar	Vadala	B.Arch	60.6%
---------------------------------	--------	--------	-------

શ્રી કચ્છી વિશા ઓસવાલ જૈન સમાજ હૈદરાબાદ રજત જયંતી સમારોહ





JUPITER PLASTICS

Behind Shed No. B-479 # B-480, Industrial Estate, Gokul Road,
HUBLI-580 030 Tel : 0836-2331264 , Cell : 9243281264
E-mail : jupiterhbl@gmail.com



geeta PLASTICS

Manufacturers : Plastic House Hold & Industrial Products

Neeligin Road, HUBLI-580 029. Tel : (O) 2250111, (R) 2366364